

અરબી-ગુજરાતી

# કુરઆને મજીદ

પારા-૫

- : પ્રકાશક : -

હાજી નાજી મેમોરીયલ ટ્રસ્ટ

માળી ટેકરા, આંબાયોક, ભાવનગર

ફોનનંબર : (૦૨૭૮) ૨૫૧૦૦૫૬ / ૨૪૨૩૭૪૬

... Kitab Downloaded from ...

[www.hajinaji.com](http://www.hajinaji.com)

● [LIKE US ON FACEBOOK](#) ●

[HOME](#) | કુરઆને મજીદ (પારા-૫) -1 | [VISIT US](#)

# નોંધ.....

→ વધુ કિતાબો ડાઉનલોડ કરવા માટે [www.hajinaji.com](http://www.hajinaji.com) પર લોગ ઓન કરો.

→ કિતાબમાં કોઈ ભૂલચૂક જણાય તો જાણ કરવા વિનંતી.

[hajinajitrust@gmail.com](mailto:hajinajitrust@gmail.com)

# અનુક્રમણિકા

નં.	સૂરાનું નામ	પેજ
૪	સૂર-એ-નિસાઅ (આયત ૨૪ થી ૧૪૭)	૪

## સૂરચે નિસા / સુરો નસા

وَالْمُحْصَنَاتُ مِنَ النِّسَاءِ إِلَّا مَا مَلَكَتْ أَيْمَانُكُمْ ۖ كَتَبَ  
اللَّهُ عَلَيْكُمْ ۖ وَأُجَلِّ لَكُمْ مَّا وَرَاءَ ذَلِكَ أَنْ تَبْتَغُوا  
بِأَمْوَالِكُمْ مُّحْصِنِينَ غَيْرَ مُسْفِحِينَ ۖ فَمَا اسْتَمْتَعْتُمْ بِهِ  
مِنْهُنَّ فَأْتُوهُنَّ أَجُورَهُنَّ فَرِيضَةً ۖ وَلَا جُنَاحَ عَلَيْكُمْ فِيمَا  
تَرْضَيْتُمْ بِهِ مِنْ بَعْدِ الْفَرِيضَةِ ۖ إِنَّ اللَّهَ كَانَ عَلِيمًا حَكِيمًا ﴿٢٤﴾

(૨૪) અને પતિવાળી સ્ત્રીઓ પણ તમારા માટે  
હરામ છે સિવાય કે (જેહાદમાં નાસ્તિકો પાસેથી  
મળી આવતાં) જે તમારી મિલકત બની ગઈ હોય;  
(આ) તમારા માટે અલ્લાહનો નક્કી કરેલો નિયમ  
છે અને એ સિવાય સઘળી (સ્ત્રીઓ) તમારા માટે

હલાલ કરવામાં આવી છે એવી શર્તે કે તમે તમારો માલ ખર્ચાને નિકાહમાં લેવાના હેતુથી તેમની ઈચ્છા કરો, ન કે કામ વાસના (તૃપ્ત કરવા) ના હેતુસર; પછી તેણીઓમાંથી જેની સાથે તમોએ સમાગમ કર્યો હોય તો તેમની ઠરાવેલી મહેર તેમને ચૂકવી દો; અને મહેર નક્કી થયા પછી કદાચને તમે અરસ પરસ કાંઈ ઓછું વધતું કરવાને રાજી થઈ જાઓ તો તમારા માથે કાંઈ ગુનોહ નથી; બેશક અલ્લાહ મહાન જાણનાર (અને) હિકમતવાળો છે.

وَمَنْ لَّمْ يَسْتَطِعْ مِنْكُمْ طَوْلًا أَنْ يَنْكِحَ الْمُحْصَنَاتِ  
 الْمُؤْمِنَاتِ فَمِنْ مَّا مَلَكَتْ أَيْمَانُكُمْ مِّنْ فَتْيَتِكُمْ

الْمُؤْمِنَاتِ ۝ وَاللَّهُ أَعْلَمُ بِإِيمَانِكُمْ ۝ بَعْضُكُمْ مِّنْ بَعْضٍ ۝  
 فَانكِحُوهُنَّ بِإِذْنِ أَهْلِهِنَّ وَآتُوهُنَّ أُجُورَهُنَّ بِالْمَعْرُوفِ  
 مُحْصَنَاتٍ غَيْرِ مُسْفَحَاتٍ وَلَا مُتَّخِذَاتِ أَخْدَانٍ ۝ فَإِذَا أَحْصَيْتِ  
 فَإِنَّ أَتَيْنَ بِفَاحِشَةٍ فَعَلَيْهِنَّ نِصْفُ مَا عَلَى الْمُحْصَنَاتِ مِنَ  
 الْعَذَابِ ۝ ذَلِكَ لِمَنْ خَشِيَ الْعَنَتَ مِنْكُمْ ۝ وَأَنْ تَصْبِرُوا  
 خَيْرٌ لَّكُمْ ۝ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ ﴿٢٥﴾

(૨૫) અને તમારામાં જે (કોઈ) આઝાદ મોઅમીન  
 સ્ત્રીઓ સાથે નિકાહ કરવાની પહોંચ ન ધરાવતો  
 હોય તો તે મોઅમીન કનીઝો કે જે તમારા  
 કબજામાં હોય (તેની) સાથે નિકાહ કરે અને

અલ્લાહ તમારા ઈમાનથી સારી પેઠે વાકેફ છે; તમે એક બીજામાંથી છો માટે તમે તેમના માલિકોની પરવાનગીથી તેમની સાથે નિકાહ કરો અને તેમની (ઠરાવેલી) મહેરો વ્યાજબી રીતે આપી દો, એવી સ્થિતિમાં કે તેણીઓ શિયળવંતીઓ હોય ન કે વ્યભિચારીણીઓ, અને ન ચોરી છુપીથી મિત્રો રાખનારીઓ, પછી જ્યારે તેણીઓ નિકાહમાં આવી જાય અને જો બદકારી કરે તો તેમના માટે આઝાદ સ્ત્રીઓનાં પ્રમાણમાં અર્ધી સજા છે; આ (આજ્ઞા) તેમના માટે છે કે તમારામાંથી જેઓ (કુંવારા હોવાના કારણે) પાપ કર્મમાં ફસાઈ જવાની ધાસ્તી રાખતા હોય; પણ જો તમે સબર

કરો તો તે તમારા માટે બેહતર છે; અને અલ્લાહ મોટો ક્ષમા કરનાર (અને) દયાળુ છે.

يُرِيدُ اللَّهُ لِيُبَيِّنَ لَكُمْ وَيَهْدِيَكُمْ سُنَنَ الَّذِينَ مِنْ قَبْلِكُمْ  
وَيَتُوبَ عَلَيْكُمْ ط وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ ﴿٢٦﴾

(૨૬) અલ્લાહ તમારા માટે તમારી પહેલાંના (સારા) લોકોના નીતી નિયમો સ્પષ્ટ કરી વર્ણવવાનો અને તે પ્રમાણે ચલાવવાનો હેતુ રાખે છે અને તમારી સાથે દયાળુપણે વર્તવા યાહે છે; અને અલ્લાહ મહાન જાણનાર (અને) હિકમતવાળો છે.



وَاللَّهُ يُرِيدُ أَنْ يَتُوبَ عَلَيْكُمْ ۖ وَيُرِيدُ الَّذِينَ يَتَّبِعُونَ  
الشَّهْوَاتِ أَنْ تَمِيلُوا مَيْلًا عَظِيمًا ﴿٢٤﴾

(૨૭) અને અલ્લાહ તમારી સાથે દયાળુપણે  
વર્તવા યાહે છે, અને જે લોકો મનોવિકારને  
અનુસરે છે તેઓ તમે (સન્માર્ગથી) એકદમ ભટકી  
જાઓ એવું ઈચ્છે છે.

يُرِيدُ اللَّهُ أَنْ يُخَفِّفَ عَنْكُمْ ۗ وَخُلِقَ الْإِنْسَانُ ضَعِيفًا ﴿٢٨﴾

(૨૮) અલ્લાહ તમારો બોજો હલકો કરી નાખવાનો  
ઈરાદો ધરાવે છે, અને ઈન્સાન માત્ર કમજોર પેદા  
કરવામાં આવ્યો છે.

يَأْتِيهَا الَّذِينَ آمَنُوا لَا تَأْكُلُوا أَمْوَالَكُمْ بَيْنَكُمْ بِالْبَاطِلِ إِلَّا  
 أَنْ تَكُونَ تِجَارَةً عَنْ تَرَاضٍ مِّنْكُمْ وَلَا تَقْتُلُوا أَنْفُسَكُمْ ط  
 إِنَّ اللَّهَ كَانَ بِكُمْ رَحِيمًا ﴿٢٩﴾

(૨૯) અય ઈમાન લાવનારાઓ! તમે આપસમાં  
 એક બીજાનો માલ નાહક ખાઈ જાઓ નહિ સિવાય  
 તે (નફો) કે જે એક બીજાની રાજી ખુશીથી કરેલા  
 વેપારમાં થયેલો હોય, અને તમો એકબીજાને કતલ  
 કરો નહિ; બેશક અલ્લાહ તમારા પર અતિ રહેમ  
 કરનારો છે.

وَمَنْ يَفْعَلْ ذَلِكَ عُدْوَانًا وَظُلْمًا فَسَوْفَ نُصَلِّيهِ نَارًا ط وَكَانَ  
 ذَلِكَ عَلَى اللَّهِ يَسِيرًا ﴿٣٠﴾

(30) અને જે કોઈ બળજબરી અથવા ગુલમ કરીને તેમ કરશે તો તેને અમે જહન્નમની આગમાં નાખી દઈશું; અને આ વાત અલ્લાહ માટે તદ્દન સહેલી છે.

إِنْ تَجْتَنِبُوا كِبَائِرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنْكُمْ سَيِّئَاتِكُمْ  
وَنُدْخِلْكُمْ مُدْخَلًا كَرِيمًا ۝۳۱

(31) જે મોટા ગુનાહો કે જેમની તમને મનાઈ કરવામાં આવી છે તેનાથી બચતા રહેશો તો અમે તમારા નાના ગુનાહોને દૂર (દરગુજર) કરી દઈશું અને અમે તમને કિર્તીવંત પ્રવેશ સ્થાનમાં દાખલ કરીશું.

وَلَا تَتَمَنَّوْا مَا فَضَّلَ اللَّهُ بِهِ بَعْضَكُمْ عَلَى بَعْضٍ ط لِّلرِّجَالِ  
 نَصِيبٌ مِّمَّا اكْتَسَبُوا ط وَلِلنِّسَاءِ نَصِيبٌ مِّمَّا اكْتَسَبْنَ ط  
 وَسَأَلُوا اللَّهَ مِنْ فَضْلِهِ ط إِنَّ اللَّهَ كَانَ بِكُلِّ شَيْءٍ عَلِيمًا ﴿٣٢﴾

(૩૨) અને તમારામાંથી કેટલાકને કેટલાકો પર  
 અલ્લાહે જે સરસાઈ આપી છે તેની ઈર્ષા કરો નહિ;  
 પુરુષોને તેમની કમાઈ (કર્મ) પ્રમાણે ભાગ મળશે  
 અને સ્ત્રીઓને તેમની કમાઈ (કર્મ) પ્રમાણે ભાગ  
 મળશે; અને અલ્લાહ પાસે રોજીના સબંધમાં તેની  
 કૃપા યાહતા રહો; બેશક અલ્લાહ દરેક વસ્તુનો  
 સંપૂર્ણ જાણકાર છે.

وَلِكُلِّ جَعَلْنَا مَوَالِيَ مِمَّا تَرَكَ الْوَالِدِينَ وَالْأَقْرَبُونَ ط وَالَّذِينَ  
 عَقَدَتْ أَيْمَانُكُمْ فَآتَوْهُمْ نَصِيْبَهُمْ ط إِنَّ اللَّهَ كَانَ عَلَىٰ كُلِّ  
 شَيْءٍ شَهِيدًا ۝

(33) અને જે (માલમત્તા) માં-બાપ અને  
 સગાંવહાલાં (પોતાની પાછળ) મૂકી જાય છે તેના  
 માટે અમે દરેકના (વાલી) વારસ નક્કી કર્યા છે;  
 અને જેમની સાથે તમારા જમણા હાથે કરાર કર્યો  
 હોય તેમને પણ તેમનો ભાગ આપી દો; બેશક  
 અલ્લાહ દરેક વસ્તુનો સાક્ષી છે.

الرِّجَالُ قَوْمُونَ عَلَى النِّسَاءِ بِمَا فَضَّلَ اللَّهُ بَعْضَهُمْ عَلَى  
 بَعْضٍ وَبِمَا أَنْفَقُوا مِنْ أَمْوَالِهِمْ ط فَالصَّالِحَاتُ قَانِتَاتٌ

حَفِظْتُ لِلْغَيْبِ بِمَا حَفِظَ اللَّهُ ۖ وَالَّتِي تَخَافُونَ نُشُوزَهُنَّ  
 فِعْظُوهُنَّ وَاهْجُرُوهُنَّ فِي الْمَضَاجِعِ وَاصْرَبُوهُنَّ ۗ فَإِنْ  
 أَطَعْنَكُمْ فَلَا تَبْغُوا عَلَيْهِنَّ سَبِيلًا ۗ إِنَّ اللَّهَ كَانَ عَلِيمًا  
 كَبِيرًا ﴿٣٣﴾

(34) પુરૂષો સ્ત્રીઓ ઉપર સત્તા ધરાવનારા છે (એક તો) એ મોટાઈના કારણે કે જે અલ્લાહે એકબીજા ઉપર આપી છે અને બીજું પોતાનો માલ (સ્ત્રીઓ માટે) ખર્ચતા હોવાના કારણે; સદાચારીણી સ્ત્રીઓ તેજ છે કે જેઓ ફરમાંબરદારી કરે છે અને અલ્લાહે તેમનું (તેમના પતિદ્વારા જેવું) રક્ષણ કર્યું છે તેવું (તેમના પતિની) ગેરહાજરીમાં પણ તેઓ દરેક

વાતનું રક્ષણ કરે છે; અને તે સ્ત્રીઓ કે જેમની નાફરમાનીનો તમને ભય હોય તેમને નસીહત કરો અને તેમને તેમની પથારીઓ પર એકલી મૂકી દો અને તેમને મારો, પછી જો તેઓ તમારી આજ્ઞા માની લે તો તેમના પર કોઈ પણ રીતે (સખ્તાઈનો) રસ્તો શોધો નહિ; બેશક અલ્લાહ ઉચ્ચ દરજ્જાવાળો (અને) મોટો છે.

وَإِنْ خِفْتُمْ شِقَاقَ بَيْنِهِمَا فَابْعَثُوا حَكَمًا مِّنْ أَهْلِهِ وَحَكَمًا  
 مِّنْ أَهْلِهَا ۗ إِنَّ يُرِيدَ إِصْلَاحًا يُّوَفِّقُ اللَّهُ بَيْنَهُمَا ۗ إِنَّ اللَّهَ  
 كَانَ عَلِيمًا خَبِيرًا ﴿٣٥﴾

(૩૫) અને જો તમને તે (પતિ-પત્ની) ની વચ્ચે બગાડ થવાનો ભય હોય તો તે (પુરુષ)ના સ્નેહીઓમાંથી; એક પંચ નીમો અને એક પંચ તે (સ્ત્રી)ના સ્નેહીઓમાંથી; જો તે બન્ને (પંચો) સલાહનો ઈરાદો રાખશે તો અલ્લાહ તે બન્નેમાં સંપ કરાવી દેશે; બેશક અલ્લાહ મહાન જાણનાર (અને) ખબરદાર છે.

وَأَعْبُدُوا اللَّهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا  
 وَبِذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسْكِينِ وَالْجَارِ ذِي الْقُرْبَىٰ وَالْجَارِ  
 الْجُنُبِ وَالصَّاحِبِ بِالْجَنبِ وَابْنِ السَّبِيلِ ۗ وَمَا مَلَكَتْ  
 أَيْمَانُكُمْ ۗ إِنَّ اللَّهَ لَا يُحِبُّ مَن كَانَ مُخْتَالًا فَخُورًا ﴿٣٦﴾



(૩૬) અને અલ્લાહનીજ ઈબાદત કરો તથા કોઈ પણ વસ્તુને તેની બરોબરીની ઠરાવો નહિ તથા માતાપિતા સાથે ભલાઈથી વર્તો તથા નજીકના સગાંવહાલાં તથા યતીમો તથા મીસ્કીનો તથા પાડોશી કુટુંબીઓ તથા પાડોશી ત્રાહીતો અને બાજુમાં બેસનારા મિત્રો તથા મુસાફરો તથા કનીઝ ગુલામો સાથે (પણ ભલાઈથી વર્તો); બેશક જેઓ અભિમાની (તથા) શેખીખોર (બડાઈ હાંકનાર) હોય છે તેમને અલ્લાહ દોસ્ત રાખતો નથી:

الَّذِينَ يَبْخُلُونَ وَيَأْمُرُونَ النَّاسَ بِالْبُخْلِ وَيَكْتُمُونَ مَا آتَاهُمُ اللَّهُ مِنْ فَضْلِهِ ۗ وَأَعْتَدْنَا لِلْكَافِرِينَ عَذَابًا مُهِينًا ﴿٣٦﴾

(૩૭) જેઓ પોતે કંજુસાઈ કરે છે અને લોકોને પણ કંજુસ બનવાની આજ્ઞા આપતા રહે છે અને અલ્લાહે પોતાની કૃપાથી તેમને જે કાંઈ આપ્યું છે તેને સંતાડે છે; અને અમોએ (અમારી આજ્ઞાઓની) અવગણના કરનારાઓ માટે હીણપત ભર્યો અઝાબ તૈયાર કર્યો છે:

وَالَّذِينَ يُنْفِقُونَ أَمْوَالَهُمْ رِئَاءَ النَّاسِ وَلَا يُؤْمِنُونَ بِاللَّهِ  
وَلَا بِالْيَوْمِ الْآخِرِ ۗ وَمَنْ يَكُنِ الشَّيْطَانُ لَهُ قَرِينًا فَسَاءَ  
قَرِينًا ﴿٣٨﴾

(૩૮) અને જેઓ (કેવળ) લોકોને દેખાડવા માટે પોતાનું ધન ખર્ચે છે અને અલ્લાહ તથા કયામત

(ના દિવસ) પર ઈમાન ધરાવતા નથી; અને  
જેમનો મિત્ર શેતાન છે તો તે કેવો બુરો મિત્ર છે !

وَمَاذَا عَلَيْهِمْ لَوْ آمَنُوا بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَأَنفَقُوا مِنَّا

رَزَقَهُمُ اللَّهُ ۖ وَكَانَ اللَّهُ بِهِمْ عَلِيمًا ﴿٣٩﴾

(૩૯) અગર તેઓ અલ્લાહ અને કયામત ઉપર  
ઈમાન લાવતે અને અલ્લાહે તેમને જે કાંઈ આપ્યું  
છે તેમાંથી (અલ્લાહના માર્ગમાં) ખર્ચ કરતે તો  
તેમનું શું (બગડી) જતે ? અને અલ્લાહ તેમનાથી  
સારી પેઠે વાકેફ છે.

إِنَّ اللَّهَ لَا يَظْلِمُ مِثْقَالَ ذَرَّةٍ ۖ وَإِنْ تَكَ حَسَنَةً يُّضِعْفُهَا

وَيُؤْتِ مِنْ لَدُنْهُ أَجْرًا عَظِيمًا ﴿٤٠﴾

(૪૦) બેશક અલ્લાહ રતી બરાબર પણ ઝુલ્મ કરતો નથી, બલકે જે કાંઈ નેકી હોય છે તે બમણી યોગણી કરી આપે છે અને પોતાની પાસેથી ઘણો મોટો બદલો આપે છે.

فَكَيْفَ إِذَا جِئْنَا مِنْ كُلِّ أُمَّةٍ بِشَهِيدٍ وَجِئْنَا بِكَ عَلَى هَؤُلَاءِ  
شَهِيدًا ﴿٣١﴾

(૪૧) પછી જ્યારે અમે દરેક ઉમ્મતમાંથી એક સાક્ષી બોલાવીશું અને તે સઘળાઓ ઉપર (અય મોહમ્મદ સ.અ.વ.) તને એક સાક્ષી તરીકે બોલાવીશું. ત્યારે (તેમની) કેવી દશા થશે?

يَوْمَئِذٍ يَوَدُّ الَّذِينَ كَفَرُوا وَعَصَوُوا الرَّسُولَ لَوْ تُسَوَّىٰ بِهِمُ  
الْأَرْضُ ۗ وَلَا يَكْتُمُونَ اللَّهَ حَدِيثًا ﴿٣٣﴾

(૪૨) તે દિવસે જેઓ ઈમાન લાવ્યા ન હશે અને જેમણે રસૂલની નાફરમાની કરી હશે તેઓ (એવું) ઈચ્છશે કે જો તેઓ જમીનદોસ્ત થઈ જાય તો કેવું સાહે; અને તેઓ (તે દિવસે) અલ્લાહથી કોઈ વાત છુપાવી શકશે નહિ.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَقْرَبُوا الصَّلَاةَ وَأَنْتُمْ سُكَرَىٰ حَتَّىٰ  
تَعْلَمُوا مَا تَقُولُونَ وَلَا جُنُبًا إِلَّا عَابِرِي سَبِيلٍ حَتَّىٰ  
تَغْتَسِلُوا ۗ وَإِنْ كُنْتُمْ مَرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ

مِنْكُمْ مِنَ الْغَائِبِ أَوْ لِمَسْتُمْ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً  
 فَتَيَبَّسُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوْهِكُمْ وَأَيْدِيكُمْ إِنَّ  
 اللَّهَ كَانَ عَفُوًّا غَفُورًا ﴿٤٣﴾

(૪૩) અથ ઈમાન લાવનારાઓ ! જ્યારે તમે નશા  
 (કેફની)ની હાલતમાં હો તો જ્યાં સુધી તમે જે કાંઈ  
 કહો છો તે સમજવા લાગો નહિ અને જ્યારે  
 નાપાકીની હાલતમાં હો-સિવાય કે તમે મુસાફરીમાં  
 હો-તો જ્યાં સુધી તમે સ્નાન ન કરી લો ત્યાં સુધી  
 નમાઝની પાસે જશો નહિ; અને જો તમે બીમાર હો  
 અથવા મુસાફરીમાં હો અથવા તમારામાંથી કોઈ  
 પાવખાનાથી (પરવારીને) આવ્યો હોય અથવા

તમે સ્ત્રીસંગ કર્યો હોય; પછી જો તમને પાણી ન મળી શકે તો પાક માટી વડે તથમ્મુમ કરી લો, પછી તમારા ચહેરાનો મસો કરી લો અને તમારા હાથોનો પણ; બેશક અલ્લાહ મોટો દરગુજર કરનાર (અને) ક્ષમાવાન છે.

أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِّنَ الْكِتَابِ يُشْتَرُونَ  
الضَّلَالََةَ وَيُرِيدُونَ أَن تَضِلُّوا السَّبِيلَ ۗ

(૪૪) શું તેં તે લોકો તરફ નજર નથી નાખી કે જેમને (અલ્લાહની) કિતાબનો કેટલોક ભાગ આપવામાં આવ્યો છે ? તેઓ ગુમરાહી ખરીદે છે

અને ઈચ્છે છે કે તમે પણ સન્માર્ગથી ભટકી જાઓ.

وَاللَّهُ أَعْلَمُ بِأَعْدَائِكُمْ ط وَكَفَى بِاللَّهِ وَلِيًّا ۖ وَكَفَى بِاللَّهِ

نَصِيرًا ﴿٤٥﴾

(૪૫) અને અલ્લાહ તમારા શત્રુઓથી સારી પેઠે વાકેફ છે; અને અલ્લાહ (તમારા) હિમાયતી તરીકે બસ છે, અને અલ્લાહ (તમારા) મદદગાર તરીકે બસ છે.

مِنَ الَّذِينَ هَادُوا يُحَرِّفُونَ الْكَلِمَ عَن مَّوَاضِعِهِ وَيَقُولُونَ  
سَمِعْنَا وَعَصَيْنَا وَاسْمَعُ غَيْرَ مُسْمِعٍ وَرَاعِنَا لِيًّا بِالسِّنْتِهِمْ  
وَطَعْنَا فِي الدِّينِ ط وَلَوْ أَنَّهُمْ قَالُوا سَمِعْنَا وَأَطَعْنَا وَاسْمَعُ



وَأَنْظُرْنَا لَكَانَ خَيْرًا لَهُمْ وَأَقْوَمًا ۖ وَلَكِنْ لَعَنَهُمُ اللَّهُ  
بِكُفْرِهِمْ فَلَا يُؤْمِنُونَ إِلَّا قَلِيلًا ﴿٣٦﴾

(૪૬) (અય રસૂલ!) જે લોકો યહૂદીઓ છે તેઓ માંહેના કેટલાકો (અલ્લાહના) શબ્દો તેમના (મૂળ) સ્થાનેથી બદલી નાખે છે અને દીનમાં ટોણો મારવાના હેતુથી કહે છે કે અમે સાંભળ્યુ અને નાફરમાની કરી અને તું સાંભળ એવું થાય કે તું સાંભળવા ન પામે અને પોતાની જીભ વાંકીવાળી "રાએના" (શબ્દ વાપરે છે); પણ જો તેઓ આ કહેતે કે અમોએ સાંભળ્યું અને આજ્ઞા માથે ચઢાવી અને તું સાંભળ અને (રાએનાના બદલે) 'ઉન્જુર'ના કહેતે તો (આ) તેમના માટે વધુ સાડું અને વધુ

યોગ્ય થતે; પરંતુ અલ્લાહે તેમની નાફરમાનીના કારણે તેમના પર ફિટકાર કરી છે માટે થોડાક સિવાય ઈમાન લાવશે નહિ.

يَا أَيُّهَا الَّذِينَ أُوتُوا الْكِتَابَ آمِنُوا بِمَا نَزَّلْنَا مُصَدِّقًا لِمَا  
مَعَكُمْ مِّن قَبْلِ أَنْ تُطِيسَ وُجُوهُهَا فَنَرُدَّهَا عَلَىٰ أَدْبَارِهَا أَوْ  
نَلْعَنَهُمْ كَمَا لَعَنَّا أَصْحَابَ السَّبْتِ ۗ وَكَانَ أَمْرُ اللَّهِ مَفْعُولًا ﴿٤٧﴾

(૪૭) અથ તે લોકો ! કે જેમને કિતાબ આપવામાં આવી છે અમોએ જે (કુરઆન) ઉતાર્યું છે તેના પર તમે ઈમાન લાવો કે જે (કુરઆન) તમારી પાસે જે (કિતાબ) છે તેને પણ સમર્થન આપે છે, એ પહેલાં કે અમે ચહેરા બગાડી નાખીએ અને પછી તેમને

પીઠ તરફ ફેરવી દઈએ અથવા તેમના પર એવી  
લાનત કરીએ જેવી કે અમોએ અસ્હાબે સબ્ત  
(શનિવારવાળા) પર કરી હતી, અને અલ્લાહનો  
હુકમ (પૂર્ણ) થઈનેજ રહેશે.

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَنْ  
يَشَاءُ ۗ وَمَنْ يُشْرِكْ بِاللَّهِ فَقَدْ افْتَرَىٰ إِثْمًا عَظِيمًا ﴿٢٨﴾

(૪૮) અલ્લાહ તેની સાથે કોઈને શરીક કરવામાં  
આવે એ હરગિજ માફ કરશે નહિ અને તે  
સિવાયનો કોઈ પણ ગુનોહ જેના માટે યાહશે તેને  
માફ કરી દેશે, અને જેણે અલ્લાહની સાથે બીજા  
કોઈને શરીક કર્યો તેણે ખરેખર એક ઘણો મોટો  
ગુનોહ ઘડી કાઢ્યો.

أَلَمْ تَرَ إِلَى الَّذِينَ يُزَكُّونَ أَنْفُسَهُمْ ۗ بَلِ اللَّهُ يُزَكِّي مَن يَشَاءُ  
وَلَا يُظْلَمُونَ فَتِيلًا ﴿٣٩﴾

(૪૯) (અથ રસૂલ!) શું તં તેમને નથી જોયાં કે  
જેઓ પોતાને પાક ઠરાવે છે ? બલકે અલ્લાહ જેને  
ચાહે છે તેનેજ પાક કરે છે અને તેમના પર  
સૂતરના તાંતણા બરાબર પણ ઝુલ્મ કરવામાં  
આવશે નહિ.

أَنْظُرْ كَيْفَ يَفْتَرُونَ عَلَى اللَّهِ الْكَذِبَ ۗ وَكَفَىٰ بِهِ إِثْمًا  
مُّبِينًا ﴿٥٠﴾

(૫૦) (અથ રસૂલ!) જો તો ખરો ! અલ્લાહ ઉપર તેઓ કેવાં ખોટાં (આળ) ચઢાવે છે? અને એક પ્રત્યક્ષ ગુનાહ માટે એ (શીક) જ પૂરતું છે.

أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيْبًا مِّنَ الْكِتَابِ يُؤْمِنُونَ بِالْحَبِيتِ  
وَالطَّاغُوتِ وَيَقُولُونَ لِلَّذِينَ كَفَرُوا هَؤُلَاءِ أَهْدَىٰ مِنَ  
الَّذِينَ آمَنُوا سَبِيلًا ﴿٥١﴾

(૫૧) (અથ રસૂલ!) શું તેં તે લોકોને નથી જોયા કે જેમને અલ્લાહની કિતાબનો કેટલોક ભાગ આપવામાં આવ્યો છે ? તેઓ મૂર્તિઓ તથા ખોટા ખુદાઓને માને છે અને જેઓ ઈન્કાર કરનારા થઈ

ગયા છે તેમના સબંધમાં કહે છે કે આ લોકો તે  
ઈમાન લાવનારાઓ કરતાં વધુ સન્માર્ગે છે.

أُولَئِكَ الَّذِينَ لَعَنَهُمُ اللَّهُ ۖ وَمَنْ يَلْعَنِ اللَّهُ فَلَنْ تَجِدَ لَهُ  
نَصِيرًا ۝

(૫૨) (અથ રસૂલ!) આ તેજ (લોકો) છે કે જેમના  
પર અલ્લાહે ફિટકાર કરી છે, અને અલ્લાહ જેના  
પર ફિટકાર કરે છે તેનો કોઈ મદદગાર તું જોશે  
નહિ.

أَمْ لَهُمْ نَصِيبٌ مِّنَ الْمُلْكِ فَإِذَا لَا يُؤْتُونَ النَّاسَ نَقِيرًا ۝

(૫૩) શું (અલ્લાહની) સલ્તનતમાં તેમનો કાંઈ ભાગ છે? જો હોતે તો પણ તેઓ લોકોને તલ ભાર પણ આપતે નહિ.

أَمْ يَحْسُدُونَ النَّاسَ عَلَىٰ مَا آتَاهُمُ اللَّهُ مِنْ فَضْلِهِ ۗ فَقَدْ آتَيْنَا آلَ إِبْرَاهِيمَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَآتَيْنَاهُمْ مُلْكًا عَظِيمًا ﴿٥٣﴾

(૫૪) અથવા શું તેઓ તે લોકોની કે જેમને અલ્લાહે પોતાની કૃપાથી જે કાંઈ આપ્યું છે (તે માટે) અદેખાઈ કરે છે ? તો બેશક અમોએ ઈબ્રાહીમની ઓલાદને કિતાબ અને મહાન બુદ્ધિ અર્પણ કરી હતી તથા તેમને ઘણી મોટી સલ્તનત આપી હતી.

فَمِنْهُمْ مَّنْ آمَنَ بِهِ وَمِنْهُمْ مَّنْ صَدَّ عَنْهُ ط وَكَفَىٰ بِجَهَنَّمَ

سَعِيرًا ﴿٥٥﴾

(૫૫) પછી તેઓમાંથી કેટલાકો તે (ઈબ્રાહીમ) પર ઈમાન લાવ્યા અને કેટલાકો તેને (માનતા) અટકી ગયા; અને તે (અટકી જનારાઓ માટે) ઘગઘગતી આગ પૂરતી છે.

إِنَّ الَّذِينَ كَفَرُوا بِآيَاتِنَا سَوْفَ نُصَلِّيهِمْ نَارًا ط كُلَّمَا نَضِجَتْ

جُلُودُهُمْ بَدَّلْنَاهُمْ جُلُودًا غَيْرَهَا لِيَذُوقُوا الْعَذَابَ ط إِنَّ اللَّهَ

كَانَ عَزِيزًا حَكِيمًا ﴿٥٦﴾

(૫૬) નિસંશય જે લોકોએ અમારી આયતોનો ઈન્કાર કર્યો છે તેમને નજીકમાં જહન્નમની આગમાં



પહોંચાડી દઈશું; જ્યારે જ્યારે તેમની ચામડીઓ બળી ગળી જશે ત્યારે ત્યારે તેઓ અઝાબની (બરાબર) મજા ચાખે એ માટે અમે બદલીને તેમને બીજી ચામડી આપીશું; બેશક અલ્લાહ જબરદસ્ત (અને) હિકમતવાળો છે.

وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَنُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا لَهُمْ فِيهَا أَزْوَاجٌ مُطَهَّرَةٌ وَنُدْخِلُهُمْ ظِلًّا ظَلِيلًا ﴿٥٤﴾

(૫૭) અને જે લોકો ઈમાન લાવ્યા છે તથા સત્કાર્યો કરે છે તેમને નજીકમાં જન્નતોમાં દાખલ કરી દઈશું જેની હેઠળ નદીઓ વહેતી રહે છે; તેમાં

તેઓ હંમેશને માટે રહી શકે; તેમાં તેમના માટે પવિત્ર પત્નિઓ હશે, અને અમે તેમને ગીયોગીય છાયામાં દાખલ કરી દઈશું.

إِنَّ اللَّهَ يَأْمُرُكُمْ أَنْ تُؤَدُّوا الْأَمَانَ إِلَىٰ أَهْلِهَا ۗ وَإِذَا حَكَمْتُمْ بَيْنَ النَّاسِ أَنْ تَحْكُمُوا بِالْعَدْلِ ۗ إِنَّ اللَّهَ نِعِمَّا يَعِظُكُمْ بِهِ ۗ إِنَّ اللَّهَ كَانَ سَمِيعًا بَصِيرًا ﴿٥٨﴾

(૫૮) (અય મુસલમાનો!) બેશક અલ્લાહ તમને (તમારી પાસેની) અમાનતો તેમના માલિકોને સોંપી દેવાની આજ્ઞા કરે છે; અને જ્યારે લોકો વચ્ચે (કોઈ વાતનો) ફેંસલો કરો તો ન્યાયની સાથે ફેંસલો કરો; એ બાબતમાં અલ્લાહ તમને જે

નસીહત કરે છે તે બેશક ઘણી ઉત્તમ છે; નિસંશય અલ્લાહ મહાન સાંભળનાર (અને) જોનાર છે.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ وَأُولِي  
الْأَمْرِ مِنْكُمْ ۗ فَإِنْ تَنَازَعْتُمْ فِي شَيْءٍ فَرُدُّوهُ إِلَى اللَّهِ  
وَالرَّسُولِ إِنْ كُنْتُمْ تُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۗ ذَلِكَ  
خَيْرٌ وَأَحْسَنُ تَأْوِيلًا ٥٩

(૫૯) અય ઈમાન લાવનારાઓ ! અલ્લાહની આજ્ઞા માનો તથા તેના રસૂલની આજ્ઞા માનો અને ઉલુલઅમ્રની પણ; પછી જો કોઈ બાબતમાં તમારી વચ્ચે કોઈ ઝઘડો થાય તો તેને અલ્લાહ તથા રસૂલની તરફ રજુ કરો અગર તમે અલ્લાહ

તથા કયામતના દિવસ પર ઈમાન ધરાવતા હો;  
(ન્યાય માટેની) તે બેહતર (પદ્ધતિ) છે અને  
પરિણામની દ્રષ્ટીએ પણ ઉત્તમ છે.

أَلَمْ تَرَ إِلَى الَّذِينَ يَزْعُمُونَ أَنَّهُمْ آمَنُوا بِمَا نُزِّلَ إِلَيْكَ وَمَا  
أُنزِلَ مِنْ قَبْلِكَ يُرِيدُونَ أَنْ يَتَّخِذُوا إِلَى الطَّاغُوتِ وَقَدْ  
أُمِرُوا أَنْ يَكْفُرُوا بِهِ ۗ وَيُرِيدُ الشَّيْطَانُ أَنْ يُضِلَّهُمْ ضَلَالًا  
بَعِيدًا ﴿٦٠﴾

(૬૦) (અથ રસૂલ!) શું તેં તે લોકોને નથી જોયા કે  
જેઓ એવું ગુમાન કરે છે કે જે કાંઈ તારા ઉપર  
અને તારી પહેલાં ઉતારવામાં આવ્યું હતું તેના પર  
ઈમાન લાવ્યા છે ? તેઓ યાહે છે કે પોતાના

મામલાઓને પોતાના એક શેતાન (યાને કઅબ બિન અશરફ નામે યહૂદી) પાસે ફેંસલા માટે લઈ જાય, જોકે તેમને તે (શેતાન) ને નકારવાની આજ્ઞા કરવામાં આવી હતી; અને શેતાન એવું ઈચ્છે છે કે તેમને (સન્માર્ગથી) ભટકાવી દૂરની ગુમરાહીમાં નાખી દે.

وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا إِلَىٰ مَا أَنزَلَ اللَّهُ وَإِلَى الرَّسُولِ رَأَيْتَ  
 الْمُنَافِقِينَ يَصُدُّونَ عَنكَ صُدُودًا ۝

(૬૧) અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે અલ્લાહે જે કાંઈ ઉતાર્યું છે તેની અને તેના રસૂલ તરફ આવો તો તું મુનાફીકોને તારી પાસેથી મોટી ધૂણા (અભાવ) સાથે ખસી જતા જોશે.

فَكَيْفَ إِذَا أَصَابَتْهُمُ مُصِيبَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ثُمَّ  
جَاءُوكَ يَخْلِفُونَ ۗ بِاللَّهِ إِنْ أَرَدْنَا إِلَّا أَحْسَنًا وَتَوَفِّيْنَا ۖ ﴿٦٢﴾

(५२) પણ તેમની દશા કેવી થશે જ્યારે તેમના હાથે કરેલા (કૃત્યો)ના કારણે તેમના પર કોઈ મુસીબત (આવી) પડશે ત્યારે તો તેઓ અલ્લાહની સોગંદ ખાતા તારી પાસે કહેતા આવશે કે અમારો ઈરાદો નેકી તથા ઐક્ય સાધવા સિવાય અન્ય કાંઈ ન હતો.

أُولَئِكَ الَّذِينَ يَعْلَمُ اللَّهُ مَا فِي قُلُوبِهِمْ ۗ فَأَعْرَضَ عَنْهُمْ  
وَعِظُهُمْ وَقُلْ لَهُمْ فِي أَنْفُسِهِمْ قَوْلًا بَلِيغًا ۖ ﴿٦٣﴾

(૬૩) આ લોકો એજ છે કે જે કાંઈ (ફસાદ) તેમના મનમાં છે તે અલ્લાહ સારી પેઠે જાણે છે, માટે તું પણ તેમને જતા કર અને તેમને નસીહત કર અને તેમના દિલોમાં અસર કરે તેવી વાતો કર.

وَمَا أَرْسَلْنَا مِنْ رَّسُولٍ إِلَّا لِيُطَاعَ بِإِذْنِ اللَّهِ ۗ وَلَوْ أَنَّهُمْ إِذْ ظَلَمُوا أَنفُسَهُمْ جَاءُوكَ فَاسْتَغْفَرُوا اللَّهَ وَاسْتَغْفَرَ لَهُمُ الرَّسُولُ لَوَجَدُوا اللَّهَ تَوَّابًا رَحِيمًا ﴿٦٣﴾

(૬૪) અને અમોએ કોઈ પણ રસૂલને (બીજા કશા માટે) નથી મોકલ્યો પણ એ માટે કે અલ્લાહના હુકમથી તેની આજ્ઞા માનવામાં આવે; અને અગર આ લોકો એજ વખતે જ્યારે તેમણે પોતાના પર

જુલમ કર્યો હતો તારી પાસે આવી જતે અને અલ્લાહથી માફી માંગતે અને રસૂલ પણ તેમના માટે ક્ષમા યાચતે તો તેઓ ખચીતજ અલ્લાહને મોટો તૌબા કબૂલ કરનાર (અને) દયાળુ પામતે.

فَلَا وَرَبِّكَ لَا يُؤْمِنُونَ حَتَّىٰ يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيْنَهُمْ ثُمَّ لَا

يَجِدُوا فِي أَنفُسِهِمْ حَرَجًا مِّمَّا قَضَيْتَ وَيُسَلِّمُوا تَسْلِيمًا ﴿٦٥﴾

(૬૫) પણ તેવું છેજ નહિ; અને તારા પરવરદિગારની કસમ! એ લોકો ઈમાન લાવ્યા છે એમ કદી પણ તું માનજે નહિ જ્યાં સુધી કે તે ઝઘડાઓમાં (તેના નિર્ણય માટે) તને તેઓ નિર્ણાયક બનાવે; પછી તું જે કાંઈ ચુકાદો આપે



तेनाथी पोताना मनमां (लेशपण) ओछुं लावे  
नहि अने ते (युकादानो) संपूर्ण स्वीकार करे.

وَلَوْ أَنَّا كَتَبْنَا عَلَيْهِمْ أَنْ اقْتُلُوا أَنْفُسَكُمْ أَوْ اخْرَجُوا مِنْ  
دِيَارِكُمْ مَا فَعَلُوهُ إِلَّا قَلِيلٌ مِّنْهُمْ ۖ وَلَوْ أَنَّهُمْ فَعَلُوا مَا

يُوعِظُونَ بِهِ لَكَانَ خَيْرًا لَّهُمْ وَأَشَدَّ تَثْبِيثًا ﴿٣٦﴾

(५५) अने जो अमे तेमना पर आ वाजिब करी  
देते के तमे तमारा प्राणोनुं (अल्लाहनी राहमां)  
बलिदान आपो अथवा तमारा घरमांथी नीकणी  
जाओ (हिजरत करो) तो तेमनामांना थोडाक गण्था  
गांठ्या सिवाय तेओ ते करते नहि; अने जो तेमने  
जे नसीहत करवामां आवी हती ते मुजब तेओ

વર્તતે તો તેમના માટે વધારે સાડું થતે અને  
(તેમના ઈમાનની) વધુ દ્રઢતાનું કારણ બનતે.

وَإِذْ آتَيْنَاهُم مِّن لَّدُنَّا أَجْرًا عَظِيمًا ﴿٤٧﴾

(૬૭) અને તે વેળા અમે પણ તેમને અમારા  
તરફથી અવશ્ય ઘણો મોટો બદલો આપતે:

وَلَهَدَيْنَاهُمْ صِرَاطًا مُّسْتَقِيمًا ﴿٤٨﴾

(૬૮) અને ખરેખર! અમે તેમને સન્માર્ગ દેખાડી  
દેતે.

وَمَنْ يُطِيعِ اللَّهَ وَالرَّسُولَ فَأُولَٰئِكَ مَعَ الَّذِينَ أَنْعَمَ اللَّهُ  
عَلَيْهِمْ مِنَ النَّبِيِّينَ وَالصِّدِّيقِينَ وَالشُّهَدَاءِ وَالصَّالِحِينَ  
وَحَسَنَ أُولَٰئِكَ رَفِيقًا ﴿٤٩﴾

(૬૯) અને જેઓ અલ્લાહ તથા તે(ના) રસૂલની આજ્ઞા પાળે છે તો તેઓ તેમની સાથે હશે કે જેમના પર અલ્લાહે બક્ષીશો કરી છે કે જેઓ કેટલાક પયગમ્બરોમાંથી તથા સત્યવાદીઓમાંથી તથા શહીદોમાંથી અને સદાચારીઓમાંથી છે; અને એજ લોકો મિત્રતા માટે ઉત્તમ છે.

ذٰلِكَ الْفَضْلُ مِنَ اللّٰهِ وَ كَفٰى بِاللّٰهِ عَلِيْمًا ۝

(૭૦) આ અલ્લાહ તરફથી કૃપા છે; અને અલ્લાહનું સર્વજ્ઞ હોવું પૂરતું છે.

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا خُذُوْا حِذْرَكُمْ فَاَنْفِرُوْا ثُبٰتٍ اَوْ اَنْفِرُوْا

جَمِيْعًا ۝

(૭૧) અથ ઈમાન લાવનારાઓ ! (જેહાદના સમયે) તમારા રક્ષણની વ્યવસ્થા કરો પછી છુટી છવાઈ ટુકડીઓ બની નીકળો અથવા એકી સાથે નીકળી પડો.

وَإِنَّ مِنْكُمْ لَمَنْ لَيُبِطِّئَنَّ ۖ فَإِنْ أَصَابَتْكُمْ مُصِيبَةٌ قَالُوا قَدْ أَنْعَمَ اللَّهُ عَلَيْنَا ۖ وَإِذْ لَمْ أَكُنْ مَعَهُمْ شَهِيدًا ﴿٧٢﴾

(૭૨) અને નિસંશય તમારામાંથી કોઈ કોઈ ખચીતજ એવો છે કે જે (જાણી જોઈને) પાછળ રહી જાય છે; પછી કદાચને તમારા ઉપર કોઈ મુસીબત આવી પડે તો કહે છે કે ખરેજ અલ્લાહે મારા પર ઉપકાર કર્યો કે હું તેમની સાથે હાજર ન હતો.

وَلَيْنِ أَصَابِكُمْ فَضْلٌ مِّنَ اللَّهِ لَيَقُولَنَّ كَأَن لَّمْ تَكُنْ بَيْنَكُمْ

وَبَيْنَهُ مَوَدَّةٌ يُّلَيِّتُنِي كُنْتُ مَعَهُمْ فَأَفُوزَ فَوْزًا عَظِيمًا ﴿٤٣﴾

(93) અને જો તમારા પર અલ્લાહની કૃપા થઈ જાય તો જાણે તમારી અને તેની વચ્ચે કાંઈ મિત્રતા ન હોય (તેમ) જરૂર એમ કહેતે કે કેવું સારું થતે કે હું પણ તેમની સાથે હોત કે જેથી મને પણ ઘણો મોટો લાભ થતે.

فَلْيُقَاتِلْ فِي سَبِيلِ اللَّهِ الَّذِينَ يَشْرُونَ الْحَيَاةَ الدُّنْيَا  
بِالْآخِرَةِ ۗ وَمَنْ يُقَاتِلْ فِي سَبِيلِ اللَّهِ فَيُقْتَلْ أَوْ يَغْلِبْ

فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا ﴿٤٤﴾

(૭૪) માટે તે લોકો કે જેઓ પરલોકના બદલામાં આલોકની જિંદગી વેચી નાખે છે તેમને લાજિમ છે કે લડે; અને જે કોઈ અલ્લાહના માર્ગમાં લડે (અને તે માર્યો જાય અથવા વિજય મેળવે) તો અમે તેને ઘણો મોટો બદલો આપીશું.

وَمَا لَكُمْ لَا تُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّهِ وَالْمُسْتَضْعَفِينَ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ وَالْوِلْدَانِ الَّذِينَ يَقُولُونَ رَبَّنَا أَخْرِجْنَا مِنْ هَذِهِ الْقَرْيَةِ الظَّالِمِ أَهْلُهَا ۗ وَاجْعَلْ لَنَا مِنْ لَدُنْكَ وَلِيًّا ۖ وَاجْعَلْ لَنَا مِنْ لَدُنْكَ نَصِيرًا ۝

(૭૫) અને (અય મુસલમાનો!) તમને શું થઈ ગયું છે કે તમે અલ્લાહના માર્ગમાં લડતા નથી ? એ

સ્થિતિમાં કે પુરુષોમાંના તથા સ્ત્રીઓમાંના અને બાળકોમાંના અશક્તો (કે જેઓને રોકી લેવામાં આવ્યાથી) પોકારી રહ્યા છે કે અય અમારા પરવરદિગાર! અમને આ વસ્તી (મક્કા) માંથી કે જેના રહેવાસીઓ ઝાલિમ છે કાઢી લઈ જા અને તારા તરફથી અમારો કોઈ હિમાયતી ઉભો કર, અને તારા તરફથી અમારો કોઈ મદદગાર પણ પેદા કર.

الَّذِينَ آمَنُوا يُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّهِ ۗ وَالَّذِينَ كَفَرُوا  
 يُقَاتِلُونَ فِي سَبِيلِ الطَّاغُوتِ فَقَاتِلُوا أَوْلِيَاءَ الشَّيْطَانِ ۗ  
 إِنَّ كَيْدَ الشَّيْطَانِ كَانَ ضَعِيفًا ۝

(૭૬) જેઓ ઈમાન લાવ્યા છે તેઓ તો અલ્લાહનાજ માર્ગમાં લડે છે, અને જેઓ ઈમાન લાવ્યા નથી તેઓ તાગુત (શેતાન)ની રાહમાં લડે છે. માટે તમે શેતાનના મિત્રો સામે લડો; નિસંશય શેતાનનો મક્કર પોકળ છે.

أَلَمْ تَرَ إِلَى الَّذِينَ قِيلَ لَهُمْ كُفُّوا أَيْدِيَكُمْ وَأَقِيمُوا الصَّلَاةَ  
 وَآتُوا الزَّكَاةَ ۖ فَلَمَّا كُتِبَ عَلَيْهِمُ الْقِتَالُ إِذَا فَرِيقٌ مِنْهُمْ  
 يَخْشَوْنَ النَّاسَ كَخَشْيَةِ اللَّهِ أَوْ أَشَدَّ خَشْيَةً ۖ وَقَالُوا رَبَّنَا لِمَ  
 كَتَبْتَ عَلَيْنَا الْقِتَالَ ۗ لَوْلَا أَخَّرْتَنَا إِلَىٰ أَجَلٍ قَرِيبٍ ۗ قُلْ



مَتَاعُ الدُّنْيَا قَلِيلٌ ۖ وَالْآخِرَةُ خَيْرٌ لِّمَنِ اتَّقَىٰ ۗ وَلَا تُظْلَمُونَ  
فَتِيلًا ۝۴۴

(૭૭) (અય રસૂલ!) શું તેં તેમને નથી જોયા કે જેમને કહેવામાં આવ્યું (હતું) કે તમારા હાથ (જંગથી) રોકી લો તથા નમાઝ પઢતા રહો અને ઝકાત આપતા રહો પછી જ્યારે તેમના પર જેહાદ વાજિબ કરવામાં આવ્યું ત્યારે તેઓ માંહેનું એક ટોળું લોકોથી એવું ડરવા લાગ્યું જેમકે અલ્લાહથી ડરવું જોઈએ અથવા તે કરતાંય વધારે, અને તેઓ કહેવા લાગ્યા કે અય અમારા પરવરદિગાર ! તેં અમારા પર શા માટે ધર્મયુદ્ધ વાજિબ કર્યું ? અમને વધુ થોડાક દિવસની મોહલત કેમ ન આપી? તું

કહે કે આલોકનો વૈભવ ક્ષણ માત્રનો છે, અને પરલોક (ની જિંદગી) પરહેઝગારો માટે બેહતર છે; અને તમારા પર એક સુતરના તાંતણા બરાબર પણ અન્યાય કરવામાં આવશે નહિ.

أَيْنَ مَا تَكُونُوا يُدْرِكُكُمُ الْمَوْتُ وَلَوْ كُنْتُمْ فِي بُرُوجٍ

مُشِيدَةٍ ۖ وَإِنْ تُصِبْهُمْ حَسَنَةٌ يَقُولُوا هَذِهِ مِنْ عِنْدِ اللَّهِ ۖ

وَإِنْ تُصِبْهُمْ سَيِّئَةٌ يَقُولُوا هَذِهِ مِنْ عِنْدِكَ ۖ قُلْ كُلُّ مِّنْ

عِنْدِ اللَّهِ ۖ فَمَالِ هَؤُلَاءِ الْقَوْمِ لَا يَكَادُونَ يَفْقَهُونَ حَدِيثًا ﴿٧٤﴾

(૭૮) (યાદ રાખો) જ્યાં પણ તમે હશો મૃત્યુ તમને (અવશ્ય) પકડી પાડશે, પછી ભલેને તમે મજબુત કિલ્લાઓમાં પણ કેમ ન હો. અને (તેમની સ્થિતિ

એવી છે) કે જો તેમને કાંઈ લાભ થાય છે તો કહે છે કે આ અલ્લાહ તરફથી છે, અને જો તેમને કાંઈ નુકસાન પહોંચે છે તો કહે છે કે આ તારા તરફથી છે; (અય રસૂલ!) તું કહેકે સઘળું અલ્લાહ તરફથીજ છે; પછી આ લોકોને શું થઈ ગયું છે કે આટલી (સરળ) વાત પણ સમજવાના પ્રયત્નો કરતા નથી?

مَا أَصَابَكَ مِنْ حَسَنَةٍ فَمِنَ اللَّهِ وَمَا أَصَابَكَ مِنْ سَيِّئَةٍ فَمِنَ

نَفْسِكَ ۖ وَأَرْسَلْنَاكَ لِلنَّاسِ رَسُولًا ۖ وَكَفَى بِاللَّهِ شَهِيدًا ﴿٩٧﴾

(૭૯) (અય માનવી!) જે લાભ તને પહોંચે છે તે તો અલ્લાહ તરફથી જ છે, અને જે નુકસાન તને પહોંચે છે તે તારા પોતાના તરફથી છે; અને (અય

રસૂલ!) અમોએ તને તમામ લોકો માટે સંદેશો  
પહોંચાડનાર બનાવી મોકલ્યો છે; અને અલ્લાહ  
સાક્ષી માટે બસ છે.

مَنْ يُطِيعِ الرَّسُولَ فَقَدْ أَطَاعَ اللَّهَ ۗ وَمَنْ تَوَلَّىٰ فَمَا أَرْسَلْنَاكَ  
عَلَيْهِمْ حَفِيظًا ۗ

(૮૦) જેણે રસૂલની આજ્ઞા માની તેણે ખરેખર  
અલ્લાહની આજ્ઞા માની; અને જે ફરી બેઠો તો  
અમોએ તને તેમના ઉપર રખેવાળ તરીકે નથી  
મોકલ્યો.

وَيَقُولُونَ طَاعَةٌ فَإِذَا بَرَزُوا مِنْ عِنْدِكَ بَيَّتَ طَائِفَةٌ مِّنْهُمْ  
 غَيْرَ الَّذِي تَقُولُ ۖ وَاللَّهُ يَكْتُبُ مَا يُبَيِّتُونَ ۚ فَأَعْرِضْ  
 عَنْهُمْ وَتَوَكَّلْ عَلَى اللَّهِ ۖ وَكَفَىٰ بِاللَّهِ وَكِيلًا ﴿٨١﴾

(૮૧) અને (તેમની હાલત એવી છે કે) તેઓ  
 (મોઢેથી તો) કહે છે કે અમે આજ્ઞાંકિત છીએ, પણ  
 જ્યારે તારી પાસેથી બહાર ચાલ્યા જાય છે ત્યારે  
 તેઓ માંહેનું એક ટોળું રાત્રિ (ના વખતે) જે કાંઈ તું  
 કહે છે તેથી જુદીજ રીતે વર્તવાનો નિર્ણય કરે છે;  
 અને રાત્રે તેઓ જે કાંઈ નિર્ણય કરે છે તે અલ્લાહ  
 લખતો જાય છે, માટે (હવે) તું (તેમની પરવા ન  
 કરતાં) તેમનાથી મોઢું ફેરવી લે અને અલ્લાહ

ઉપર ભરોસો રાખ; અને અલ્લાહ કાર્ય સાધકતા માટે પૂરતો છે.

أَفَلَا يَتَذَكَّرُونَ الْقُرْآنَ ۖ وَلَوْ كَانَ مِنْ عِنْدِ غَيْرِ اللَّهِ لَوَجَدُوا فِيهِ اخْتِلَافًا كَثِيرًا ﴿٨٢﴾

(૮૨) તો શું તેઓ કુરઆન પર મનન કરતા નથી? અને જો તે અલ્લાહના સિવાય બીજા કોઈની પાસેથી આવ્યું હોત તો ખરેજ તેમાં ઘણોજ તફાવત જણાઈ આવતે.

وَإِذَا جَاءَهُمْ أَمْرٌ مِنَ الْأَمْنِ أَوْ الْخَوْفِ أذَاعُوا بِهِ ۖ وَلَوْ رَدُّوهُ إِلَى الرَّسُولِ وَإِلَى أُولِي الْأَمْرِ مِنْهُمْ لَعَلِمَهُ الَّذِينَ

يَسْتَبْطُونَهُ مِنْهُمْ ط وَلَوْ لَا فَضْلُ اللَّهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ  
لَاتَّبَعْتُمُ الشَّيْطَانَ إِلَّا قَلِيلًا ﴿٨٣﴾

(૮૩) અને જ્યારે તેમને નિર્ભયતા અગર ભયની કોઈ વાત માલૂમ પડી જાય છે તો તે સર્વત્ર ફેલાવી દે છે; પણ જો તેઓ તે (વાત)ને પોતાના રસૂલ અને તેઓ માંહેના સત્તાધારીઓ સામે રજુ કરી દેતે તો તેઓમાંથી જેઓ વાતની ઊંડાણમાં પહોંચી જનારાઓ છે તેઓ તે (ની વસ્તુ સ્થિતિ) પારખી કાઢતે, અને જો તમારા પર અલ્લાહની કૃપા તથા દયા ન હોત તો તમે ઘણાં થોડાક સિવાય સઘળાજ શેતાનના અનુયાયીઓ બની ગયા હોત.

فَقَاتِلْ فِي سَبِيلِ اللَّهِ ۚ لَا تُكَلَّفُ إِلَّا نَفْسَكَ وَحَرِّضِ  
 الْمُؤْمِنِينَ ۚ عَسَى اللَّهُ أَنْ يَكْفِ بِأَسِ الَّذِينَ كَفَرُوا ۗ وَاللَّهُ  
 أَشَدُّ بَأْسًا وَأَشَدُّ تَنْكِيلًا ﴿٨٣﴾

(૮૪) માટે (અથ રસૂલ!) તું અલ્લાહના માર્ગમાં  
 લડ, અને તારી જાત સિવાય તું બીજા કોઈનો  
 જવાબદાર નથી અને મોઅમીનોને (જેહાદ માટે)  
 જાગૃત કરતો રહે; સંભવિત છે કે અલ્લાહ ઈમાન  
 નહિ લાવનારાઓના બળને રોકી દે; અને અલ્લાહ  
 બળના પ્રમાણમાં સૌથી વધારે બળવાન છે અને  
 ઘડા (નસીહત) રૂપ શિક્ષા કરવામાં સૌથી વધારે  
 સખત છે.



مَنْ يَشْفَعُ شَفَاعَةً حَسَنَةً يَكُنْ لَهُ نَصِيبٌ مِّنْهَا ۗ وَمَنْ  
 يَشْفَعُ شَفَاعَةً سَيِّئَةً يَكُنْ لَهُ كِفْلٌ مِّنْهَا ۗ وَكَانَ اللَّهُ عَلَىٰ كُلِّ  
 شَيْءٍ مُّقْبِلًا ۝٨٥

(૮૫) જે કોઈ સારી ભલામણ કરશે તેમાંથી તેને  
 પણ ભાગ મળશે, અને જે કોઈ બૂરી ભલામણ  
 કરશે તો તેમાંથી પણ તેને ભાગ મળશે; અને  
 અલ્લાહ દરેક વસ્તુ પર સંપૂર્ણ કાબૂ ધરાવનાર છે

وَإِذَا حُيِّيتُمْ بِتَحِيَّةٍ فَحَيُّوا بِأَحْسَنَ مِنْهَا أَوْ رُدُّوهَا ۗ إِنَّ اللَّهَ
 كَانَ عَلَىٰ كُلِّ شَيْءٍ حَسِيبًا ۝٨٦

(૮૬) અને જ્યારે તમને સલામ કરવામાં આવે  
 ત્યારે તમે તે કરતાંય ઉમદા રીતે સલામ કરો

અથવા તેના (જેવોજ) જવાબ આપો; બેશક અલ્લાહ દરેક વસ્તુનો પૂરો હિસાબ લેનાર છે.

اللَّهُ لَا إِلَهَ إِلَّا هُوَ ۖ لَيَجْمَعَنَّكُمْ إِلَى يَوْمِ الْقِيَامَةِ لَا رَيْبَ فِيهِ ۗ وَمَنْ أَصْدَقُ مِنَ اللَّهِ حَدِيثًا ۝

(૮૭) અલ્લાહ કે જેના સિવાય અન્ય કોઈ પૂજ્ય નથી - કયામતના દિવસે તમો સઘળાઓને તે અવશ્ય ભેગા કરશે કે જેના વિશે સહેજ પણ સંદેહ નથી; અને વાતોમાં અલ્લાહથી વધારે સાચું (બોલનાર) કોણ છે?

فَمَا لَكُمْ فِي الْمُنَافِقِينَ فِئَتَيْنِ وَاللَّهُ أَرْكَسَهُم بِمَا كَسَبُوا ط  
 أَتْرِيدُونَ أَنْ تَهْتَدُوا مَنْ أَضَلَّ اللَّهُ ط وَمَنْ يُضِلِّ اللَّهُ فَلَنْ تَجِدَ  
 لَهُ سَبِيلًا ﴿٨٧﴾

(૮૮) (અથ મુસલમાનો!) તમને શું થઈ ગયું છે કે  
 ઠાંભિકોના સબંધમાં બે પક્ષો થઈ ગયા છો, જો કે  
 અલ્લાહે તેઓના આમાલ (કર્મ)ના કારણે તેમની  
 બુદ્ધિ ઉલ્ટાવી નાખી છે (તેઓને નાસ્તિકપણા તરફ  
 પાછા ફેરવી દીધા છે)? શું તમે એવો ઈરાદો રાખો  
 છો કે અલ્લાહે જેમને આડે માર્ગે રહેવા દીધા છે  
 તેમને તમે સન્માર્ગે લઈ આવો? અને જેનાથી  
 અલ્લાહ હિદાયતની પ્રેરણા છીનવી લે છે તેના

માટે તું હરગિજ કોઈ (હિદાયતનો) માર્ગ મેળવી શકશે નહિ.

وَدُّوا لَوْ تَكْفُرُونَ كَمَا كَفَرُوا فَتَكُونُونَ سَوَاءً فَلَا تَتَّخِذُوا

مِنْهُمْ أَوْلِيَاءَ حَتَّىٰ يُهَاجِرُوا فِي سَبِيلِ اللَّهِ ۗ فَإِن تَوَلَّوْا

فَتَحْذَوْهُمْ وَأَقْتُلُوهُمْ حَيْثُ وَجَدْتُمُوهُمْ ۖ وَلَا تَتَّخِذُوا

مِنْهُمْ وُلِيًّا وَلَا نَصِيرًا ﴿٨٩﴾

(૮૯) તેમની તો એવી ઈચ્છા છે કે જેવી રીતે પોતે ઈમાન નથી લાવ્યા તેવી રીતે તમે પણ ઈમાન નહિ લાવનારા બની જાઓ કે જેથી તમે સૌ સમાન થઈ જાઓ; માટે તમે તેમનામાંથી (કોઈને પણ) મિત્ર ન બનાવો જ્યાં સુધી કે તેઓ અલ્લાહના

માર્ગમાં સ્વદેશનો ત્યાગ ન કરે; પછી જો તેઓ મોઢું ફેરવી લે તો તેઓ જ્યાં પણ તમને મળે ત્યાં તેમને પકડી લો અને મારી નાખો, અને તેઓમાંથી ન કોઈને મિત્ર બનાવો અને ન મદદગાર;

إِلَّا الَّذِينَ يَصِلُونَ إِلَىٰ قَوْمِ بَيْنَكُمْ وَبَيْنَهُمْ مِّيثَاقٌ أَوْ جَاءُوكُمْ حَصِرَتْ صُدُورُهُمْ أَنْ يُقَاتِلُوكُمْ أَوْ يُقَاتِلُوا قَوْمَهُمْ ۗ وَلَوْ شَاءَ اللَّهُ لَسَلَّطَهُمْ عَلَيْكُمْ فَلَقَاتِلُوكُمْ ۚ فَإِنْ اعْتَزَلُوكُمْ فَلَمْ يُقَاتِلُوكُمْ وَالْقَوَا إِلَيْكُمْ السَّلَامَ ۗ فَمَا جَعَلَ اللَّهُ لَكُمْ عَلَيْهِمْ سَبِيلًا ۝٩٠

(૯૦) સિવાય કે જો તેઓ એવી કોમ સાથે જઈ મળ્યા હોય કે તમારી અને તે કોમ વચ્ચે કોલ કરાર થયા

હોય અથવા તમારી પાસે એવી હાલતમાં આવે કે  
 તમારી સાથે લડવામાં અથવા પોતાની કોમ સાથે  
 લડવામાં તેમના મન સંકોચાતા હોય (તો તેમને  
 ઈજા ન પહોંચાડો); અને જો અલ્લાહ યાહતે તો  
 તેમને અવશ્ય તમારા પર સત્તાવાન કરી દીધા  
 હોત, પછી તેઓ તમારી સાથે અવશ્ય લડ્યા હોત;  
 માટે જો તેઓ તમારાથી અલગ રહે તથા તમારી  
 સાથે ન લડે અને તમને સુલેહ (કરવા) માટે  
 સંદેશો મોકલે તો (તેમના પર સખ્તાઈ કરવાનો)  
 અલ્લાહે તમારા માટે કોઈ માર્ગ રાખ્યો નથી.

سَتَجِدُونَ أَخْرَبِينَ يُرِيدُونَ أَنْ يَأْمَنُوا كُمْ وَيَأْمَنُوا قَوْمَهُمْ ط  
 كَلَّمَا رُدُّوا إِلَى الْفِتْنَةِ أُرْكِسُوا فِيهَا ۗ فَإِنْ لَّمْ يَعْتَزِلُوا كُمْ

وَيُلْقُوا إِلَيْكُمُ السَّلَامَ وَيَكْفُرُوا أَيْدِيَهُمْ فَنُحِذُّهُمْ  
 وَاقْتُلُوهُمْ حَيْثُ ثَقِفْتُمُوهُمْ ط وَأُولَئِكَ جَعَلْنَا لَكُمْ  
 عَلَيْهِمْ سُلْطَانًا مُّبِينًا ۝۹۱

(૯૧) નજીકમાં તમે બીજા કેટલાકોને જોશો કે તેઓ તમારાથી નિર્ભય રહેવા ઈચ્છે છે તેમ પોતાની કોમથી પણ બચ્યા રહેવાનું ઈચ્છે છે; જ્યારે પણ તેમને ફિત્ના તરફ બોલાવવામાં આવે છે ત્યારે આંખો મીંચીને તેમાં ફૂટી પડે છે; માટે જો તે લોકો તમારાથી અળગા ન થાય અને તમારાથી સુલેહની માંગણી ન કરે તથા (લડાઈ કરતાં) પોતાના હાથ ન રોકે તો તેમને પકડી લો અને

જ્યાં તેમને જુઓ મારી નાખો; અને તેમના ઉપર  
અમોએ તમને ખુલ્લી સત્તા આપી દીધી છે.

وَمَا كَانَ لِمُؤْمِنٍ أَنْ يَقتُلَ مُؤْمِنًا إِلَّا خَطَاً ۗ وَمَنْ قَتَلَ  
مُؤْمِنًا خَطَاً فَتَحْرِيرُ رَقَبَةٍ مُؤْمِنَةٍ وَدِيَةٌ مُسَلَّمَةٌ إِلَىٰ أَهْلِهِ إِلَّا  
أَنْ يَصَّدَّقُوا ۗ فَإِنْ كَانَ مِنْ قَوْمٍ عَدُوٍّ لَكُمْ وَهُوَ مُؤْمِنٌ  
فَتَحْرِيرُ رَقَبَةٍ مُؤْمِنَةٍ ۗ وَإِنْ كَانَ مِنْ قَوْمٍ بَيْنَكُمْ وَبَيْنَهُمْ  
مِيثَاقٌ فَدِيَةٌ مُسَلَّمَةٌ إِلَىٰ أَهْلِهِ وَتَحْرِيرُ رَقَبَةٍ مُؤْمِنَةٍ ۗ فَمَنْ  
لَمْ يَجِدْ فَصِيَامَ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِ تَوْبَةً مِّنَ اللَّهِ ۗ وَكَانَ  
اللَّهُ عَلِيمًا حَكِيمًا ﴿٩٢﴾



(૯૨) અને કોઈ પણ મોમીનને આ શોભતું નથી કે તે કોઈ મોમીનને મારી નાખે સિવાય કે ભૂલથી, અને જે કોઈ અજાણતામાં કોઈ મોમીનને મારી નાખે તો તેના માટે એક ઈમાનદાર ગુલામ આઝાદ કરવાનું છે તથા તે (માર્યા ગયેલા)ના વારસોને ખૂનનો આર્થિક બદલો આપવાનું છે સિવાય કે તેઓ માફ કરી દે; પણ જો માર્યો ગયેલો કોઈ એવી કોમનો હોય કે જે તમારી દુશ્મન છે છતાં મોમીન હોય તો (પણ ખૂનીને માથે) એક ઈમાનદાર ગુલામ આઝાદ કરવાનું છે; અને જો એવી કોમનો હોય કે તેની અને તમારી સંધિ હોય તો તેના વારસોને ખૂનનો સંપૂર્ણ આર્થિક

બદલો આપવો તથા એક ઈમાનદાર ગુલામ પણ આઝાદ કરવો; પછી જેને (ગુલામ આઝાદ કરવાને) ન મળે તો અલ્લાહ તરફથી (નિર્માણ કરેલા) પ્રશ્નાતાપ કરવા માટે તેના શિરે સતત બે માસના રોઝા છે; અને અલ્લાહ મોટો જાણનાર (અને) હિકમતવાળો છે.

وَمَنْ يَّقْتُلْ مُؤْمِنًا مُتَعَمِّدًا فَجَزَاؤُهُ جَهَنَّمُ خُلْدًا فِيهَا  
وَعُذِبَ اللَّهُ عَلَيْهِ وَلَعْنَةُ وَأَعَدَّ لَهُ عَذَابًا عَظِيمًا ﴿٦٣﴾

(૯૩) અને જો કોઈ જાણી જોઈને કોઈ મોઅમીનને મારી નાખે તો તેની સજા જહન્નમ છે તેમાં તે હંમેશ માટે રહેશે અને અલ્લાહ તેના પર ક્રોધ

ઉતારશે અને તેના ઉપર ફિટકાર કરશે અને (તે ઉપરાંત) તેના માટે મોટો અઝાબ તૈયાર કરશે.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا ضَرَبْتُمْ فِي سَبِيلِ اللَّهِ فَتَبَيَّنُوا وَلَا  
تَقُولُوا لِمَنْ أَلْقَى إِلَيْكُمُ السَّلَامَ لَسْتَ مُؤْمِنًا ۗ تَبْتَغُونَ  
عَرَضَ الْحَيَاةِ الدُّنْيَا فَعِنْدَ اللَّهِ مَغَانِمٌ كَثِيرَةٌ ۖ كَذَلِكَ  
كُنْتُمْ مِنْ قَبْلُ فَمَنْ اللَّهُ عَلَيْكُمْ فَتَبَيَّنُوا ۗ إِنَّ اللَّهَ كَانَ بِمَا  
تَعْمَلُونَ خَبِيرًا ﴿٦٣﴾

(૯૪) અય ઈમાન લાવનારાઓ! જ્યારે તમે અલ્લાહના માર્ગમાં (જેહાદ માટે) મુસાફરી કરતા હો તો ખાત્રી કરી લીધા સિવાય જેણે તમને સલામ કરી હોય તેને (લુટવાના હેતુથી) "તું મોઅમીન

નથી" એમ કહી દેતા નહિ. તમે આલોકની જિંદગીના લાભ શોધો છો પણ અલ્લાહની પાસે જ પુષ્કળ લાભો છે; તમે પણ પ્રથમ એવા જ હતા પછી અલ્લાહે તમારા પર ઉપકાર કર્યો જેથી ખાત્રી કરી લેતા રહો; નિસંશય તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ છે.

لَا يَسْتَوِي الْقُعْدُونَ مِنَ الْمُؤْمِنِينَ غَيْرُ أُولِي الضَّرَرِ  
 وَالْمُجَاهِدُونَ فِي سَبِيلِ اللَّهِ بِأَمْوَالِهِمْ وَأَنْفُسِهِمْ ۖ فَضَّلَ اللَّهُ  
 الْمُجَاهِدِينَ بِأَمْوَالِهِمْ وَأَنْفُسِهِمْ عَلَى الْقُعْدِينَ دَرَجَةً ۖ وَكُلًّا  
 وَعَدَّ اللَّهُ الْحُسْنَى ۖ وَفَضَّلَ اللَّهُ الْمُجَاهِدِينَ عَلَى الْقُعْدِينَ أَجْرًا  
 عَظِيمًا ۙ

(૯૫) મોઅમીનોમાંથી તેઓ કે જેમને કોઈ જાતની ઈજા પહોંચી ન હોય છતાં ઘરે બેસી રહે તેઓ તથા અલ્લાહના માર્ગમાં પોતાના જાન માલથી જેહાદ કરનારાઓ (અલ્લાહ પાસે દરજ્જામાં) સમાન નથી; (બલકે) પોતાના જાનમાલથી જેહાદ કરનારાઓને અલ્લાહે બેસી રહેનારાઓ પર દરજ્જામાં શ્રેષ્ઠતા આપી છે; જો કે સારા બદલાનો વાયદો તો દરેકથી કર્યો છે; અને અલ્લાહે જેહાદ કરનારાઓને ઘણો મોટો બદલો આપીને તેમને બેસી રહેનારાઓ પર શ્રેષ્ઠતા આપી છે.

دَرَجَاتٍ مِّنْهُ وَمَغْفِرَةً وَرَحْمَةً ط وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا ٩٦

(૯૬) આ તેના તરફના દરજ્જા ક્ષમા અને દયા છે; અને અલ્લાહ મોટો માફ કરનાર (અને) દયાળુ છે.

إِنَّ الَّذِينَ تَوَفَّيْتَهُمُ الْمَلَائِكَةُ ظَالِمِي أَنفُسِهِمْ قَالُوا فِيمَ كُنْتُمْ ط قَالُوا كُنَّا مُسْتَضْعَفِينَ فِي الْأَرْضِ ط قَالُوا أَلَمْ تَكُنْ أَرْضَ اللَّهِ وَاسِعَةً فَتُهَاجِرُوا فِيهَا ط فَأُولَئِكَ مَأْوَاهُمْ جَهَنَّمُ ط وَسَاءَتْ مَصِيرًا ﴿٩٦﴾

(૯૭) બેશક જે લોકો પોતાના જીવ પર ઝુલમ કરતા રહ્યા તેમનો અંત ફરિશ્તાઓ આવ્યા બાદ તેમને કહેશે કે તમે (તમારું જીવન) કેવી સ્થિતિમાં (વિતાડતા) હતા? તેઓ જવાબ આપશે કે અમને

જમીન પર અશક્ત બનાવી દેવામાં આવ્યા હતા; (ત્યારે ફરીથી) ફરિશ્તાઓ પૂછશે કે શું અલ્લાહની ભૂમિ વિશાળ ન હતી કે જેમાં તમે હિજરત કરી જતે? માટે એજ લોકો છે કે જેમનું ઠેકાણું જહન્નમ છે; અને તે (ઘણીજ) ખરાબ પાછા ફરવાની જગ્યા છે;

إِلَّا الْمُسْتَضْعَفِينَ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ وَالْوِلْدَانَ لَا  
يَسْتَطِيعُونَ حِيلَةً وَلَا يَهْتَدُونَ سَبِيلًا ﴿٩٨﴾

(૯૮) સિવાય તે પુરૂષો તથા સ્ત્રીઓ અને બાળકો માંહેના જે ખરેખરા લાયકાર હોય તથા કોઈ (લડાઈના) સાધનની શક્તિ ધરાવતા ન હોય અને

ન (પોતાના છુટકારા માટે) કોઈ માર્ગ મેળવી શકતા હોય;

فَأُولَئِكَ عَسَى اللَّهُ أَنْ يَعْفُوَ عَنْهُمْ ط وَكَانَ اللَّهُ عَفْوًا غُفُورًا ۞۹۹

(૯૯) તો તેવાઓથી કદાચને અલ્લાહ દરગુજર કરે; અને અલ્લાહ દરગુજર કરનાર (અને) મહા ક્ષમાવાન છે.

وَمَنْ يُهَاجِرْ فِي سَبِيلِ اللَّهِ يَجِدْ فِي الْأَرْضِ مُرْعَمًا كَثِيرًا  
وَسَعَةً ط وَمَنْ يُخْرِجْ مِنْ بَيْتِهِ مُهَاجِرًا إِلَى اللَّهِ وَرَسُولِهِ ثُمَّ  
يُدْرِكُهُ الْمَوْتُ فَقَدْ وَقَعَ أَجْرُهُ عَلَى اللَّهِ ط وَكَانَ اللَّهُ غُفُورًا

رَّحِيمًا ۞



(૧૦૦) અને જે કોઈ અલ્લાહના માર્ગમાં હિજરત કરશે તો તે ભૂમિમાં (રહેવા માટે) ઘણી આરામની જગ્યા તથા ખાવા માટે પુષ્કળ સામગ્રીઓ મેળવશે; અને જે અલ્લાહ તથા રસૂલ તરફ હિજરતના ઈરાદાથી પોતાના ઘરથી (ચાલી) નીકળે પછી તેને મૃત્યુ આવી જાય તો તેનો બદલો ખરેખર અલ્લાહના શિરે ઠરી ચૂકયો; અને અલ્લાહ મોટો માફ કરનાર (અને) દયા કરનાર છે.

وَإِذَا ضَرَبْتُمْ فِي الْأَرْضِ فَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَنْ تَقْضُوا  
 مِنَ الصَّلَاةِ ۖ إِنَّ خِفْتُمْ أَنْ يُفْتِنَكُمْ الَّذِينَ كَفَرُوا ۗ إِنَّ  
 الْكُفْرِينَ كَانُوا أَلَكُمُ عَدُوًّا مُّبِينًا ﴿١٠١﴾

(૧૦૧) અને જ્યારે પૃથ્વી પર મુસાફરી કરતા હો  
 અને ઈમાન નહિ લાવનારાઓ (તમને નમાઝમાં  
 પઢતા જોઈને) ઈજા પહોંચાડશે એવો તમને ભય  
 હોય તો તમે નમાઝમાં કમી (કસર) કરી દો, તેમ  
 કરવામાં ખરે જ તમારા ઉપર કાંઈ દોષ નથી;  
 બેશક ઈમાન નહિ લાવનારાઓ તમારા ખુલ્લા  
 દુશ્મન છે.

وَإِذَا كُنْتَ فِيهِمْ فَأَقَمْتَ لَهُمُ الصَّلَاةَ فَلْتَقُمْ طَائِفَةٌ مِنْهُمْ  
 مَعَكَ وَلِيَأْخُذُوا أَسْلِحَتَهُمْ ۗ فَإِذَا سَجَدُوا فَلْيَكُونُوا مِنْ  
 وَرَائِكُمْ ۚ وَلْتَأْتِ طَائِفَةٌ أُخْرَى لَمْ يُصَلُّوا فَلْيُصَلُّوا مَعَكَ  
 وَلِيَأْخُذُوا حِذْرَهُمْ وَأَسْلِحَتَهُمْ ۗ وَذَ الَّذِينَ كَفَرُوا لَوْ

تَغْفُلُونَ عَنْ أَسْلِحَتِكُمْ وَأَمْتِعَتِكُمْ فَيَمِيلُونَ عَلَيْكُمْ  
 مَيْلَةً وَاحِدَةً ۖ وَلَا جُنَاحَ عَلَيْكُمْ إِنْ كَانَ بِكُمْ أَذًى مِّنْ  
 مَّطَرٍ أَوْ كُنْتُمْ مَّرْضَىٰ أَنْ تَضَعُوا أَسْلِحَتَكُمْ ۖ وَخُذُوا  
 حِذْرَكُمْ ۗ إِنَّ اللَّهَ أَعَدَّ لِلْكَافِرِينَ عَذَابًا مُّهِينًا ﴿١٠٢﴾

(૧૦૨) અને (અથ રસૂલ!) જ્યારે તું તેમનામાં  
 (મોજૂદ) હોય અને તું (લડાઈ ચાલુ હોય તે વખતે)  
 તેમને નમાઝ પઢાવવા માંડે તો લાઝિમ છે કે  
 તેઓ માંહેનુ એક ટોળું તારી સાથે નમાઝ પઢવા  
 ઉભું થઈ જાય અને પોતાના હથિયાર પણ સાથે  
 રાખે; પછી જ્યારે તેઓ સિજદો કરી ચૂકે (યાને  
 નમાઝ પુરી કરી ચૂકે) તો તેમને લાઝિમ છે કે

તમારી પાછળ આવી જાય, અને બીજુ ટોળું કે જેણે  
હજી નમાઝ પઢી નથી તે આગળ આવે પછી તે  
તારી સાથે નમાઝ પઢે અને તેમને પણ લાઝિમ  
છે કે તેઓ સ્વરક્ષણની વસ્તુઓ તથા શસ્ત્રો સાથેજ  
રાખે; ઈમાન નહિ લાવનારાઓ (એવું) ઈચ્છે છે કે  
જો તેઓ તમને શસ્ત્ર અને સામાન રહીત જુએ તો  
તેઓ એકી સાથે ઓચિંતો તમારા પર હુમલો કરી  
દે; અને જો તમને વરસાદથી તકલીફ થતી હોય  
અથવા તમે માંદા હો તો તમે હથિયાર (નમાઝ  
વખતે) મૂકી દો તો તેમાં તમારા પર કાંઈ દોષ  
નથી, અને (એજ મુજબ) તમારું રક્ષણ કરો; બેશક

અલ્લાહે ઈમાન નહિ લાવનારાઓ માટે ફજેત કરનારો અઝાબ તૈયાર કર્યો છે.

فَإِذَا قُضِيَتْكُمْ الصَّلَاةُ فَادْكُرُوا اللَّهَ قِيَمًا وَقُعُودًا وَعَلَىٰ جُنُوبِكُمْ ۗ فَإِذَا اطْمَأْنَنْتُمْ فَأَقِيمُوا الصَّلَاةَ ۗ إِنَّ الصَّلَاةَ كَانَتْ عَلَىٰ الْمُؤْمِنِينَ كِتَابًا مَّوْقُوتًا ﴿١٠٣﴾

(૧૦૩) પછી જ્યારે તમે નમાઝ પૂર્ણ કરી ચૂકો તો ઉભા ઉભા અને બેઠા બેઠા અને પડખાભેર સૂતા સૂતા અલ્લાહની યાદ કરતા રહો; પછી જ્યારે તમે નિર્ભય થઈ જાઓ ત્યારે (પૂરે પુરી) નમાઝો પઢો; બેશક મોઅમીનો પર ઠરાવેલા સમયે નમાઝ પઢવાનું વાજીબ કરવામાં આવ્યું છે.

وَلَا تَهِنُوا فِي ابْتِغَاءِ الْقَوْمِ ط إِنَّ تَكُونُوا تَأْلَمُونَ فَإِنَّهُمْ  
يَأْلَمُونَ كَمَا تَأْلَمُونَ ء وَتَرْجُونَ مِنَ اللَّهِ مَا لَا يَرْجُونَ ط وَكَانَ  
اللَّهُ عَلِيمًا حَكِيمًا ۝

(૧૦૪) અને તે (દુશ્મન) લોકોની પૂઠ પકડવામાં  
હિમ્મત હારો નહિ; જો તમને કાંઈ કષ્ટ ખમવું પડે  
છે તો તેમને પણ એવી જ રીતે કષ્ટ ખમવું પડે છે  
જેવી રીતે કે તમને ખમવું પડે છે, પણ તમે  
અલ્લાહ (પાસે)થી (કૃપાની) જે આશા રાખો છો  
તેવી આશા તેઓ રાખતા નથી; અને અલ્લાહ  
મહાન જાણનાર (તથા) હિકમતવાળો છે.

إِنَّا أَنْزَلْنَا إِلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ لِتَحْكُمَ بَيْنَ النَّاسِ بِمَا  
أَرَاكَ اللَّهُ ۗ وَلَا تَكُنْ لِلْخَائِبِينَ خَصِيمًا ۝

(૧૦૫) (અય રસૂલ!) બેશક અમોએ તારી તરફ  
આ કિતાબ સત્યતા સહિત ઉતારી છે કે જેથી  
અલ્લાહે તને દેખાડયું છે તે મુજબ તું માણસો  
વચ્ચે ન્યાય કરે; અને તું વિશ્વાસઘાત  
કરનારાઓનો પક્ષ ખેંચનાર થા નહિ;

وَاسْتَغْفِرِ اللَّهُ ۗ إِنَّ اللَّهَ كَانَ غَفُورًا رَحِيمًا ۝

(૧૦૬) અને અલ્લાહથી ક્ષમા માંગ; બેશક અલ્લાહ  
મોટો ક્ષમાવાન (અને) દયા કરનાર છે.

وَلَا تُجَادِلْ عَنِ الَّذِينَ يَخْتَانُونَ أَنفُسَهُمْ ۗ إِنَّ اللَّهَ لَا يُحِبُّ  
 مَن كَانَ خَوَّانًا أَثِيمًا ﴿١٠٧﴾

(૧૦૭) અને જેઓ પોતાના અંતઃકરણોનો વિશ્વાસઘાત કરે છે તેવાઓનો પક્ષ લઈ તું (લોકો સાથે) તકરાર કર નહિ; બેશક અલ્લાહ તેમને દોસ્ત રાખતો નથી કે જેઓ વિશ્વાસઘાતી (અને) ગુનેહગાર છે;

يَسْتَخْفُونَ مِنَ النَّاسِ وَلَا يَسْتَخْفُونَ مِنَ اللَّهِ وَهُوَ مَعَهُمْ رَادُّ  
 يُبَيِّتُونَ مَا لَا يَرْضَى مِنَ الْقَوْلِ ۗ وَكَانَ اللَّهُ بِمَا يَعْمَلُونَ  
 مُحِيطًا ﴿١٠٨﴾



(૧૦૮) તેઓ (પોતાના પાપકર્મો) લોકોથી સંતાડે છે અને અલ્લાહથી સંતાડતા નથી, જો કે જ્યારે રાત્રે તેઓ એવી વાતોની સલાહ કરે છે જે અલ્લાહને પસંદ નથી ત્યારે અલ્લાહ તેમની પાસે હોય છે; અને જે કાંઈ તેઓ કરે છે તેને અલ્લાહ (પોતાના જ્ઞાનથી) ઘેરી રાખે છે.

هَآأَنْتُمْ هَآؤُلَآءِ جَدَلْتُمْ عَنْهُمْ فِي الْحَيَوةِ الدُّنْيَا فَمَنْ يُجَادِلُ

اللَّهِ عَنْهُمْ يَومَ الْقِيَمَةِ أَمْ مَنْ يَكُونُ عَلَيْهِمْ وَكِيْلًا ﴿١٠٩﴾

(૧૦૯) (અય મુસલમાનો !) આ તમેજ છો કે જેઓ દુનિયાની જિંદગીમાં તેમનો પક્ષ લઈ તકરાર કરો છો, પણ કયામતના દિવસે તેમના તરફથી

અલ્લાહ સામે કોણ તકરાર કરશે અથવા તેમનો  
વકીલ કોણ બનશે?

وَمَنْ يَّعْمَلْ سُوءًا أَوْ يَظْلِمْ نَفْسَهُ ثُمَّ يَسْتَغْفِرِ اللَّهَ يَجِدِ اللَّهَ  
غَفُورًا رَحِيمًا ﴿١١٠﴾

(૧૧૦) અને જે કોઈ અપકૃત્ય કરે અથવા પોતાની  
જાત પર કાંઈ ઝુલમ કરે, પછી અલ્લાહથી માફી  
માંગે તો અલ્લાહને મોટો માફ કરનાર (અને) રહેમ  
કરનાર પામશે.

وَمَنْ يَّكْسِبْ إِثْمًا فَإِنَّمَا يَكْسِبُهُ عَلَى نَفْسِهِ ۗ وَكَانَ اللَّهُ عَلِيمًا  
حَكِيمًا ﴿١١١﴾

(૧૧૧) અને જે પાપ કરે છે તો તે પોતાના જ માટે (નુકસાન) કરે છે; અને અલ્લાહ મહાન જાણનાર (તથા) હિકમતવાળો છે.

وَمَنْ يَكْسِبْ خَطِيئَةً أَوْ إِثْمًا ثُمَّ يَرْمِ بِهِ بَرِيئًا فَقَدِ احْتَمَلَ  
بُهْتَانًا وَإِثْمًا مُبِينًا ﴿١١٢﴾

(૧૧૨) અને જે કોઈ ભૂલ અથવા પાપ કરે છે પછી તેનું આળ (આરોપ) બીજા કોઈ નિર્દોષ ઉપર ચઢાવે તો તે ખરેખર એક ખોટાં આળ અને ખુલ્લા ગુનાહનો બોજો પોતાની (ગરદન) ઉપર ઉપાડે છે.

وَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكَ وَرَحْمَتُهُ لَهَمَّتْ طَائِفَةٌ مِّنْهُمْ أَنْ  
يُضِلُّوكَ ۖ وَمَا يُضِلُّونَ إِلَّا أَنْفُسَهُمْ ۖ وَمَا يَضُرُّونَكَ مِنْ

شَيْءٍ ط وَأَنْزَلَ اللَّهُ عَلَيْكَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَعَلَّمَكَ مَا لَمْ  
تَكُن تَعْلَمُ ط وَكَانَ فَضْلُ اللَّهِ عَلَيْكَ عَظِيمًا ﴿١١٣﴾

(૧૧૩) અને (અથ રસૂલ!) અગર તારા અલ્લાહની કૃપા અને દયા ન હોત તો તેઓમાંથી એક ટોળાએ તો તને રખડાવી દેવાનો નિશ્ચય કર્યો જ હતો, જો કે (ખરું જોતાં) તેઓ પોતાનેજ રખડાવતે અને તારું કાંઈ પણ બગાડતે નહિ; અને અલ્લાહે તારા ઉપર કિતાબ તથા હિકમત ઉતારી છે અને તું જે જાણતો ન હતો તેનું શિક્ષણ તને આપ્યું છે; અને અલ્લાહની કૃપા તારા ઉપર ઘણી મોટી છે.

لَا خَيْرَ فِي كَثِيرٍ مِّنْ نُّجُوبِهِمْ إِلَّا مَنَ أَمَرَ بِصَدَقَةٍ أَوْ مَعْرُوفٍ  
 أَوْ إِصْلَاحٍ بَيْنَ النَّاسِ ۗ وَمَن يَفْعَلْ ذَلِكَ ابْتِغَاءَ مَرْضَاتِ  
 اللَّهِ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا ﴿١١٣﴾

(૧૧૪) તેમની (ખાનગી) ચર્યાઓમાંથી  
 ઘણીખરીમાં ભલાઈનો જરાય અંશ નથી, સિવાય  
 તેમની તે (ખાનગી ચર્યાઓમાં) કે જેમાં તેઓ  
 સદકો આપવા અથવા નેકી કરવા અથવા લોકો  
 વચ્ચે મેળાપ કરાવી આપવાના સબંધમાં આજ્ઞા  
 કરે છે; અને જે કોઈ અલ્લાહની ખુશી સંપાદન  
 કરવા માટે આમ કરશે તેને અમે ઘણો મોટો  
 બદલો આપીશું.

وَمَنْ يُشَاقِقِ الرَّسُولَ مِنْ بَعْدِ مَا تَبَيَّنَ لَهُ الْهُدَىٰ وَيَتَّبِعْ  
 غَيْرَ سَبِيلِ الْمُؤْمِنِينَ نُوَلِّهِ مَا تَوَلَّىٰ وَنُصَلِّهِ جَهَنَّمَ ط  
 وَسَاءَتْ مَصِيرًا ۝

(૧૧૫) અને જે કોઈ તેના ઉપર સત્ય જાહેર થઈ  
 ગયા પછી રસૂલની વિરુદ્ધતા ધારણ કરશે, અને  
 મોઅમીનોના માર્ગ સિવાય બીજો માર્ગ પકડશે, તો  
 અમે પણ તેને એજ (માર્ગ પર) ચલાવીશું કે જે  
 તેણે (પોતે) પસંદ કર્યો છે અને તેને જહન્નમમાં  
 પહોંચાડીશું; અને તે ઘણીજ ખરાબ પાછા ફરવાની  
 જગ્યા છે.

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَنْ يَشَاءُ ۗ وَمَنْ يُشْرِكْ بِاللَّهِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا ﴿١١٦﴾

(૧૧૬) બેશક અલ્લાહ તેની સાથે કોઈને શરીક કરવાનો ગુનોહ નહિજ માફ કરે અને એ (શિક) સિવાયના ગુનાહ જેને યાહશે તેને માફ કરી દેશે; અને જેણે અલ્લાહથી શિક કર્યું તો તે ખરેખર (સન્માર્ગથી) રખડી ઘણો દૂર ભટકી ગયો.

إِنْ يَدْعُونَ مِنْ دُونِ اللَّهِ إِلَّا إِنشَاءً ۗ وَإِنْ يَدْعُونَ إِلَّا شَيْطَانًا مَّرِيدًا ﴿١١٦﴾

(૧૧૭) તેઓ અલ્લાહના સિવાય નથી પોકારતા  
કિંતુ (દેવ) દેવીઓને અને નથી પોકારતા કિંતુ  
અવળચંડા શેતાનને;

لَعْنَةُ اللَّهِ مُوقَالَ لَا تَتَّخِذَنَّ مِنْ عِبَادِكَ نَصِيبًا مَفْرُوضًا ﴿١١٨﴾

(૧૧૮) જેના પર અલ્લાહે લાનત કરી છે; અને  
તેણે કહ્યું હતું કે હું તારા બંદાઓમાંથી એક ચોક્કસ  
ભાગ જરૂર લઈશ;

وَالَّذِينَ هُمْ يَأْتِيهِمُ الْمَلَأَةُ لِيَلْعَنُوهُمْ وَلَا يَضُرُّهُمْ وَلَا يَنْفَعُهُمْ وَالَّذِينَ هُمْ يَأْتِيهِمُ الْمَلَأَةُ لِيَلْعَنُوهُمْ وَلَا يَضُرُّهُمْ وَلَا يَنْفَعُهُمْ وَالَّذِينَ هُمْ يَأْتِيهِمُ الْمَلَأَةُ لِيَلْعَنُوهُمْ وَلَا يَضُرُّهُمْ وَلَا يَنْفَعُهُمْ  
الْأَنْعَامِ وَالْمَرْءِ يَأْتِيهِمُ الْمَلَأَةُ لِيَلْعَنُوهُمْ وَلَا يَضُرُّهُمْ وَلَا يَنْفَعُهُمْ وَالَّذِينَ هُمْ يَأْتِيهِمُ الْمَلَأَةُ لِيَلْعَنُوهُمْ وَلَا يَضُرُّهُمْ وَلَا يَنْفَعُهُمْ  
الشَّيْطَانَ وَلِيَأْمِنَنَّ دُونَ اللَّهِ فَقَدْ خَسِرَ خُسْرًا مُبِينًا ﴿١١٩﴾



(૧૧૯) અને હું તેમને જરૂર સન્માર્ગથી ભટકાવીશ અને તેમને જૂઠી આશાઓથી અવશ્ય લોભાવીશ. અને હું તેમને જરૂર (એવી) આજ્ઞા પર ચલાવીશ કે જેથી તેઓ ચોપગા (પ્રાણી)ઓના કાન ચીરી નાખશે અને હું તેમને જરૂર આજ્ઞા કરીશ (કે) જેથી તેઓ અલ્લાહના સર્જનને જરૂર બદલી નાંખશે; અને જે કોઈ અલ્લાહને ત્યજી શેતાનને મિત્ર બનાવશે તે ખરેજ ખુલ્લી (ચોક્કસ) હાનિ ભોગવશે.

يَعِدُهُمْ وَيُمَنِّيهِمْ ۖ وَمَا يَعِدُهُمُ الشَّيْطَانُ إِلَّا غُرُورًا ﴿١٢٠﴾

(૧૨૦) તે (શેતાન) તેમને વાયદા કરે છે અને તેમને ખોટી આશામાં નાખે છે; અને શેતાન તેમને વાયદો નથી કરતો પણ કેવળ ધોખોજ આપે છે.

أُولَئِكَ مَا أُولَهُمْ جَهَنَّمَ ۚ وَلَا يَجِدُونَ عَنْهَا مَحِيصًا ﴿١٢١﴾

(૧૨૧) એજ લોકોનું ઠેકાણું જહન્નમ છે, જેમાંથી નાસવાની તક તેઓ કદી પણ મેળવશે નહિ.

وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَنُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي

مِنْ تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ وَعَدَّ اللَّهُ حَقًّا ۖ وَمَنْ

أَصْدَقُ مِنَ اللَّهِ قِيلًا ﴿١٢٢﴾

(૧૨૨) અને જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા તેમને અમે નજીકમાં બગીચાઓમાં દાખલ કરી દઈશું જેની નીચે નદીઓ વહેતી રહે છે, (અને) તેમાં તેઓ હંમેશ હંમેશને માટે રહેશે;

અલ્લાહનો વાચદો સાચો છે; અને વચનના સંબંધમાં અલ્લાહ કરતાં વધારે સાચો કોણ હશે?

لَيْسَ بِأَمَانِيِّكُمْ وَلَا أَمَانِي أَهْلِ الْكِتَابِ ط مَنْ يَّعْمَلْ سُوءًا  
يُجْزِ بِهِ ۖ وَلَا يَجِدْ لَهُ مِنْ دُونِ اللَّهِ وَلِيًّا وَلَا نَصِيرًا ﴿١٢٣﴾

(૧૨૩) તમારી ખોટી આશાઓ તથા કિતાબવાળાઓની ખોટી આશાઓને (અલ્લાહના એ વાચદા સાથે) કાંઈ સંબંધ નથી; જે કોઈ બદી કરશે તેને તે (બદી)નો બદલો મળશે, અને અલ્લાહના સિવાય તે ન કોઈને પોતાનો હિમાયતી જોશે અને ન મદદગાર.

وَمَنْ يَعْمَلْ مِنَ الصَّالِحَاتِ مِنْ ذَكَرٍ أَوْ أُنْثَىٰ وَهُوَ مُؤْمِنٌ  
فَأُولَٰئِكَ يَدْخُلُونَ الْجَنَّةَ وَلَا يُظْلَمُونَ نَقِيرًا ﴿١٢٤﴾

(૧૨૪) અને જે કોઈ કાંઈ નેકી કરશે એવી સ્થિતિમાં કે તે મોઅમીન પણ હોય, પછી ભલેને તે પુરુષ હોય કે સ્ત્રી-તેઓજ તો જન્મતમાં દાખલ થશે, અને તેમના પર તલભાર પણ ઝુલમ કરવામાં આવશે નહિ.

وَمَنْ أَحْسَنُ دِينًا مِّمَّنْ أَسْلَمَ وَجْهَهُ لِلَّهِ وَهُوَ مُحْسِنٌ وَاتَّبَعَ  
مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا ۗ وَاتَّخَذَ اللَّهُ إِبْرَاهِيمَ خَلِيلًا ﴿١٢٥﴾

(૧૨૫) અને જેણે પોતાને અલ્લાહની તાબેદારી માટે ઝુકાવી દીધો હોય અને વળી તે પરોપકારી

પણ હોય અને નિખાલસપણે ઈબ્રાહીમના ચુસ્ત ધર્મનો અનુયાયી પણ થઈ ગયો હોય તો તેના કરતાં ધર્મના સબંધમાં વધુ ઉત્તમ કોણ હશે ? અને અલ્લાહે ઈબ્રાહીમને પોતાનો મિત્ર કરી લીધો છે.

وَلِلَّهِ مَا فِي السَّمٰوٰتِ وَمَا فِي الْاَرْضِ ط وَكَانَ اللّٰهُ بِكُلِّ شَيْءٍ  
 حٰكِمًا ۝

(૧૨૬) અને જે કાંઈ આકાશોમાં છે તથા જે કાંઈ જમીનમાં છે તે સઘળું અલ્લાહનું છે; અને અલ્લાહે દરેક વસ્તુને (પોતાના જ્ઞાનથી) ઘેરી રાખી છે.

وَيَسْتَفْتُونَكَ فِي النِّسَاءِ ط قُلِ اللّٰهُ يُفْتِيكُمْ فِيهِنَّ ۚ وَمَا يُتْلٰى عَلَيْكُمْ فِي الْكِتٰبِ فِي يَتِمِّي النِّسَاءِ الَّتِي لَا تُوْتُوْنَهُنَّ مَا

كُتِبَ لَهُنَّ وَتَرْغَبُونَ أَنْ تَنْكِحُوهُنَّ وَالْمُسْتَضْعَفِينَ مِنَ  
 الْوِلْدَانِ ۖ وَأَنْ تَقُومُوا لِلْيَتَامَىٰ بِالْقِسْطِ ۗ وَمَا تَفَعَّلُوا مِنْ  
 خَيْرٍ فَإِنَّ اللَّهَ كَانَ بِهِ عَلِيمًا ﴿١٢٤﴾

(૧૨૭) અને (અથ રસૂલ!) લોકો (અનાથ) સ્ત્રીઓ  
 સબંધી તારી પાસે ફતવો માંગે છે; તું કહે કે  
 અલ્લાહ (તેમના) સબંધમાં તમને (નિકાહ માટેની  
 પરવાનગીનો) ફતવો આપે છે, અને (કુરઆનમાં)  
 જે (હુકમ અગાઉ) તમને વાંચી સંભળાવવામાં  
 આવ્યો છે તે ખરેખર એવી અનાથ (લાવારસ)  
 સ્ત્રીઓ સબંધી છે કે જેમને તમે (તેમનાં હક) જે  
 તેમને માટે ઠરાવવામાં આવ્યા છે તે આપતા નથી,

અને (તેમ છતાં પણ) તેમની સાથે નિકાહ કરવાની ઈચ્છા ધરાવો છો, અને એજ પ્રમાણે અશક્ત બાળકોના સબંધમાં (હુકમ આપે છે), અને તે આ કે તમે યતીમોના સબંધમાં ન્યાયપૂર્વક વર્તતા રહો; અને જે પણ નેકી તમે કરશો અલ્લાહ તેનાથી ખરેખર જાણકાર છે.

وَإِنَّ امْرَأَةً خَافَتْ مِنْ بَعْلِهَا نُشُوزًا أَوْ إِعْرَاضًا فَلَا جُنَاحَ عَلَيْهِمَا أَنْ يُصْلِحَا بَيْنَهُمَا صُلْحًا وَالصُّلْحُ خَيْرٌ وَأُحْضِرَتِ الْأَنْفُسُ الشُّحَّ وَإِنْ تُحْسِنُوا وَتَتَّقُوا فَإِنَّ اللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا ﴿۱۴۸﴾

(૧૨૮) અને જે કોઈ સ્ત્રીને પોતાના ઘણી તરફથી ગેરવર્તન અથવા બેદરકારીનો અંદેશો હોય તો જો તેઓ કોઈ રીતે પરસ્પર સમાધાન કરી લે તો તેમના પર કાંઈ દોષ નથી; અને સમાધાન કરવું એ વધારે સાફ છે; અને (મનુષ્ય માત્રના) સ્વભાવમાં કંજૂસાઈ (ધન લોભ) સમાએલું હોય છે; અને જો તમે ભલાઈ કરો અને પરહેઝગાર રહો તો જે કાંઈ તમે કરો છો તેનાથી અલ્લાહ સારી પેઠે વાકેફ છે.



وَلَنْ تَسْتَطِيعُوا أَنْ تَعْدِلُوا بَيْنَ النِّسَاءِ وَلَوْ حَرَصْتُمْ فَلَا  
 تَمِيلُوا كُلَّ الْمَيْلِ فَتَذَرُوهَا كَالْمُعَلَّقَةِ ۗ وَإِنْ تُصْلِحُوا  
 وَتَتَّقُوا فَإِنَّ اللَّهَ كَانَ غَفُورًا رَحِيمًا ﴿١٢٩﴾

(૧૨૯) અને તમે ગમે તેટલું ઈચ્છશો તો પણ તમારી (સઘળી) સ્ત્રીઓ વચ્ચે તમે ન્યાયથી હરગિજ વર્તી શકશો નહિ, માટે તમે તદ્દન (એક સ્ત્રી તરફ) વળી જતા નહિ કે જેથી તે (બીજી સ્ત્રીઓ)ને લટકતી સ્થિતિમાં લાવી મૂકો; અને જો તમે સમાધાન કરો તથા બૂરાઈથી બચો તો બેશક અલ્લાહ મોટો માફ કરનાર (અને) દયા કરનાર છે.

وَإِنْ يَتَفَرَّقَا يُغْنِ اللَّهُ كُلًّا مِّنْ سَعَتِهِ ۗ وَكَانَ اللَّهُ وَاسِعًا

حَكِيمًا ﴿١٣٠﴾

(૧૩૦) અને જો તેઓ બંને જુદા થઈ જાય તો અલ્લાહ દરેકને પોતાના વિશાળ (ખજાનામાં)થી માલદાર કરી દેશે; અને અલ્લાહ મહાન દાતા (અને) હિકમતવાળો છે.

وَلِلَّهِ مَا فِي السَّمٰوٰتِ وَمَا فِي الْاَرْضِ ۗ وَلَقَدْ وَصَّيْنَا الَّذِيْنَ

اٰتٰوْا الْكِتٰبَ مِنْ قَبْلِكُمْ وَاِيَّاكُمْ اَنْ اتَّقُوا اللَّهَ ۗ وَانْ

تَكْفُرُوْا فَاِنَّ لِلّٰهِ مَا فِي السَّمٰوٰتِ وَمَا فِي الْاَرْضِ ۗ وَكَانَ اللَّهُ

غَنِيًّا حَمِيْدًا ﴿١٣١﴾

(૧૩૧) અને જે કાંઈ આકાશોમાં છે તથા જે કાંઈ જમીનમાં છે તે સઘળું અલ્લાહનું જ છે; અને ખરેખર અમે તે લોકોને કે જેમને તમારી પહેલાં કિતાબ આપવામાં આવી હતી અને ખુદ તમને પણ આ તાકીદ આપી છે કે અલ્લાહથી ડરતા રહો; પણ જો તમે અનુપકારી બનશો તો આકાશો તથા જમીનમાં જે કાંઈ છે તે તો અલ્લાહનું જ છે; અને અલ્લાહ બેપરવાહ (અને) વખાણને પાત્ર છે.

وَلِلّٰهِ مَا فِي السَّمٰوٰتِ وَمَا فِي الْاَرْضِ ۗ وَكَفٰى بِاللّٰهِ وَكِيلًا ﴿١٣٢﴾

(૧૩૨) અને જે આકાશોમાં છે તથા જે કાંઈ જમીનમાં છે તે અલ્લાહનું છે; અને કાર્ય સાધકતા માટે અલ્લાહ પૂરતો છે.

إِنْ يَشَاءُ يُذْهِبْكُمْ أَيُّهَا النَّاسُ وَيَأْتِ بِآخَرِينَ ۗ وَكَانَ اللَّهُ عَلَىٰ  
ذَلِكَ قَدِيرًا ﴿١٣٣﴾

(૧૩૩) અથ લોકો ! જો તે યાહે તો તમને ફના કરી નાખે ને તમારા બદલે બીજાઓને લાવી વસાવે; અને અલ્લાહ તેમ કરવા માટે સંપૂર્ણ શક્તિ ધરાવે છે.

مَنْ كَانَ يُرِيدُ ثَوَابَ الدُّنْيَا فَعِنْدَ اللَّهِ ثَوَابُ الدُّنْيَا  
وَالْآخِرَةِ ۗ وَكَانَ اللَّهُ سَمِيعًا بَصِيرًا ﴿١٣٤﴾

(૧૩૪) જે કોઈ દુનિયાનો બદલો યાહે છે તો અલ્લાહની પાસે દુનિયાનો બદલો હાજર છે અને

આખેરતનો પણ; અને અલ્લાહ મહાન સાંભળનાર  
(અને) નિહાળનાર છે.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُونُوا قَوْمِينَ بِالْقِسْطِ شُهَدَاءَ لِلَّهِ وَلَوْ  
عَلَىٰ أَنفُسِكُمْ أَوِ الْوَالِدِينَ وَالْأَقْرَبِينَ ۚ إِنَّ يَكُونُ غَنِيًّا أَوْ  
فَقِيرًا فَاللَّهُ أَوْلَىٰ بِمَا تَقُولُونَ فَلَا تَتَّبِعُوا الْهَوَىٰ أَنْ تَعْدِلُوا ۗ وَإِنْ  
تَلَّوْا أَوْ تُعْرَضُوا فَإِنَّ اللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا ﴿١٣٥﴾

(૧૩૫) અથ ઈમાન લાવનારાઓ ! તમે હંમેશા  
ન્યાયને વળગી રહી અલ્લાહ માટે સાક્ષી  
આપનારા બનો, પછી ભલેને તે (સાક્ષી) તમારા  
પોતાની અથવા (તમારા) માંબાપ અને સ્નેહીઓ  
વિરુદ્ધ કેમ ન હોય; જો (તેમનામાં) ધનવાન હોય કે

મોહતાજ, દરેક હાલતમાં અલ્લાહ (મહેરબાની કરવામાં) બંનેની સૌ કરતાં વધુ નજીક છે; માટે તમે તમારી મનોવાસનાને આધીન થાઓ નહિ, કે જેથી તમે ઈન્સાફ કરી ન શકો; પણ જો તમે સાક્ષી આપવામાં જીભ દબાવશો અથવા મોઢું ફેરવી લેશો, તો જે કાંઈ પણ તમે કરશો તેનાથી અલ્લાહ બેશક સારી રીતે વાકેફ છે.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا آمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَالْكِتَابِ الَّذِي نَزَّلَ  
 عَلَىٰ رَسُولِهِ وَالْكِتَابِ الَّذِي أَنْزَلَ مِنْ قَبْلُ ۗ وَمَنْ يَكْفُرْ  
 بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ وَالْيَوْمِ الْآخِرِ فَقَدْ ضَلَّ  
 ضَلَالًا بَعِيدًا ﴿١٣٦﴾

(૧૩૬) અથ ઈમાન લાવનારાઓ ! તમે અલ્લાહ પર તથા તેના રસૂલ પર અને તે કિતાબ પર જે તેણે પોતાના રસૂલ પર ઉતારી છે અને તે કિતાબ પર કે જે તેણે પ્રથમ ઉતારી છે ઈમાન લાવો; અને જે કોઈ અલ્લાહનો તથા તેના ફરિશ્તાઓનો તથા તેની કિતાબોનો તથા તેના રસૂલોનો અને છેલ્લા દિવસનો ઈન્કાર કરશે, તે ખરેખર સન્માર્ગથી ઘણે દૂર ભટકી જશે.

إِنَّ الَّذِينَ آمَنُوا ثُمَّ كَفَرُوا ثُمَّ آمَنُوا ثُمَّ كَفَرُوا ثُمَّ  
 أَزْدَادُوا كُفْرًا لَّمْ يَكُنِ اللَّهُ لِيَغْفِرْ لَهُمْ وَلَا لِيَهْدِيَهُمْ  
 سَبِيلًا ﴿١٣٦﴾

(૧૩૭) નિસંશય જે લોકો ઈમાન લાવ્યા (અને) પાછા ઈમાનથી ફરી ગયા, પછી પાછા ઈમાન લાવ્યા અને પાછા ઈમાનથી ફરી ગયા, પછી પોતાના નાસ્તિકપણામાં વધારો કર્યો તો અલ્લાહ એવો નથી કે તેવાઓને માફ કરે અને ન એ કે તેમને સન્માર્ગે પહોંચાડે.

بَشِيرِ الْمُنْفِقِينَ بِأَنَّ لَهُمْ عَذَابًا أَلِيمًا ﴿١٣٨﴾

(૧૩૮) (અય રસૂલ!) તે દાંભિકોને આ ખુશખબર સંભળાવી દે કે ખરેજ તેમના માટે દુઃખદાયક અઝાબ છે;



الَّذِينَ يَتَّخِذُونَ الْكُفْرِينَ أَوْلِيَاءَ مِنْ دُونِ الْمُؤْمِنِينَ ط  
 أَيَّبَتُّغُونَ عِنْدَهُمُ الْعِزَّةَ فَإِنَّ الْعِزَّةَ لِلَّهِ جَمِيعًا ۝

(૧૩૯) કે જેઓ મોઅમીનોને છોડી મુશરીકો કાફિરોને મિત્ર બનાવે છે; શું તેઓ તેમની પાસે ઈજ્જત શોધે છે? પણ નિસંશય સઘળી ઈજ્જત તો અલ્લાહને માટે જ છે.

وَقَدْ نَزَّلَ عَلَيْكُمْ فِي الْكِتَابِ أَنْ إِذَا سَمِعْتُمْ آيَاتِ اللَّهِ يُكْفَرُ  
 بِهَا وَيُسْتَهْزَأُ بِهَا فَلَا تَقْعُدُوا مَعَهُمْ حَتَّى يَخُوضُوا فِي حَدِيثٍ  
 غَيْرِهِ ۗ إِنَّكُمْ إِذَا مِثْلَهُمْ ط إِنَّ اللَّهَ جَامِعُ الْمُنْفِقِينَ  
 وَالْكَافِرِينَ فِي جَهَنَّمَ جَمِيعًا ۝

(૧૪૦) અને ખરેજ તે તમારા ઉપર ક્રિતાબમાં આ હુકમ ઉતારી ચૂક્યો છે કે જે વખતે તમે સાંભળો કે અલ્લાહની આયતોનો ઈન્કાર કરવામાં આવે છે અને તેની હાંસી ઉડાડવામાં આવે છે, તો તમે એવા લોકો પાસે બેસી ન રહો જ્યાં સુધી કે તેઓ બીજી કોઈ વાતચીત શરૂ કરે નહિ; નહિતર તમે પણ તે હાલતમાં તેમનાજ જેવા થઈ જશો; બેશક અલ્લાહ સઘળા દાંભિકો અને નાફરમાનોને જહન્નમમાં ભેગા કરનાર છે;

الَّذِينَ يَتَّبِعُونَ بِكُمْ ۖ فَإِنْ كَانَ لَكُمْ فِتْحٌ مِّنَ اللَّهِ قَالُوا  
 أَلَمْ نَكُنْ مَّعَكُمْ ۗ وَإِنْ كَانَ لِلْكَافِرِينَ نَصِيبٌ ۖ قَالُوا أَلَمْ

نَسْتَحُوذُ عَلَيْكُمْ وَمَنْعَكُمْ مِنَ الْمُؤْمِنِينَ ط فَاللَّهُ يَحْكُمُ  
 بَيْنَكُمْ يَوْمَ الْقِيَمَةِ ط وَلَنْ يَجْعَلَ اللَّهُ لِلْكَافِرِينَ عَلَى  
 الْمُؤْمِنِينَ سَبِيلًا ۝

(૧૪૧) જેઓ (તમારા પર કોઈ મુસીબત આવી પડવાની) વાટ જોતા રહે છે; પછી જ્યારે અલ્લાહ તરફથી તમારો વિજય થાય છે ત્યારે કહે છે કે શું અમે તમારી સાથે ન હતા ? અને જો નાફરમાનોને લાભ મળી જાય છે ત્યારે કહે છે કે શું અમે તમારા પર વિજયી થઈ ગયા ન હતા? અને (તે પછી) શું અમોએ તમને મોઅમીનોથી બચાવ્યા ન હતા ? પછી અલ્લાહ કયામતના દિવસે તમારી વચ્ચે

ફેસલો કરી દેશે; અને અલ્લાહ ઈમાન ન લાવનારાઓને મોઅમીનો પર હરગિજ તક આપશે નહિ.

إِنَّ الْمُنْفِقِينَ يُخَدِعُونَ اللَّهَ وَهُوَ خَادِعُهُمْ ۖ وَإِذَا قَامُوا إِلَى  
الصَّلَاةِ قَامُوا كَسَالَى ۖ يُرْآءُونَ النَّاسَ وَلَا يَذْكُرُونَ اللَّهَ  
إِلَّا قَلِيلًا ﴿١٣٣﴾

(૧૪૨) બેશક દાંભિકો અલ્લાહને ધોખો આપવાના પ્રયત્ન કરે છે. પણ તે (અલ્લાહ) તેમને જ ધોખો આપનાર છે; અને જે વેળા તેઓ નમાઝ માટે ઉભા થાય છે તો આળસાઈથી ઉભા થાય છે; લોકોને

દેખાડવા માટે જ ઉભા થાય છે અને અલ્લાહનો  
ઝિક્ર ઘણોજ થોડો કરે છે;

مُذَبِّبِينَ بَيْنَ ذَلِكَ ۖ لَا إِلَىٰ هُوَآءٍ وَلَا إِلَىٰ هُوَآءٍ ط وَمَنْ  
يُضِلِلِ اللّٰهُ فَلَنْ تَجِدَ لَهُ سَبِيْلًا ﴿١٣٣﴾

(૧૪૩) તેઓ (ઈમાન અને બેઈમાની)ની વચ્ચે  
ડામાડોળ છે, ન આ તરફ છે ન પેલી તરફ; અને  
જેનાથી અલ્લાહ હિદાયતની તોફીક ખુંચવી લે છે  
તો તું તેના માટે હરગિજ કોઈ (હિદાયત) માર્ગ  
મેળવી શકશે નહિ.

يَأَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا الْكُفْرِينَ أَوْلِيَاءَ مِنْ دُونِ  
 الْمُؤْمِنِينَ ط أَتُرِيدُونَ أَنْ تَجْعَلُوا لِلَّهِ عَلَيْكُمْ سُلْطَانًا  
 مُبِينًا ﴿١٣٣﴾

(१४४) अथ ईमान लावनाराओ ! मोमीनोने मूकी  
 काङ्करोने मित्र बनावो नहि; शुं तमे अेम याहो छो  
 के तमारी पोतानी विरुद्ध अल्लाहना माटे भुल्ली  
 दलील कायम करी लो ?

إِنَّ الْمُنْفِقِينَ فِي الدَّرَكِ الْأَسْفَلِ مِنَ النَّارِ ۖ وَلَنْ تَجِدَ لَهُمْ  
 نَصِيرًا ﴿١٣٥﴾

(૧૪૫) નિસંશય દાંભિકો જહન્નમનાં સૌથી નીચેના તબક્કામાં હશે, અને તું તેમના માટે કોઈ મદદગાર જોશે નહિ;

إِلَّا الَّذِينَ تَابُوا وَأَصْلَحُوا وَاعْتَصَمُوا بِاللَّهِ وَأَخْلَصُوا دِينَهُمْ  
لِلَّهِ فَأُولَئِكَ مَعَ الْمُؤْمِنِينَ ۝ وَسَوْفَ يُؤْتِي اللَّهُ الْمُؤْمِنِينَ  
أَجْرًا عَظِيمًا ﴿١٣٣﴾

(૧૪૬) સિવાય તેમના કે જેઓ તૌબા કરી લે અને સુધારણા કરે તથા અલ્લાહને દ્રઢતાપૂર્વક વળગી રહે અને અલ્લાહના જ માટે પોતાના ધર્મને નિર્મળ કરી રાખે તો તેઓજ મોમીનોની સાથે રહેશે; અને અલ્લાહ મોમીનોને ઘણો મોટો બદલો આપશે.

مَا يَفْعَلُ اللَّهُ بِعَذَابِكُمْ إِنْ شَكَرْتُمْ وَآمَنْتُمْ ۖ وَكَانَ اللَّهُ

شَاكِرًا عَلِيمًا ﴿١٤﴾

(૧૪૭) જો તમે શુક્ર કરો અને ઈમાન લાવો તો અલ્લાહ તમને શા માટે અઝાબ આપે ? અને અલ્લાહ કદર કરનાર (અને) સર્વજ્ઞ છે.